

Super Visa/ Visitor to Canada Insurance



- Best Mortgage Rates
- 1st and 2nd Mortgages
- Life and Critical Illness Insurance
- RRSP/RESP/INVESTMENTS

Ph.: 416-839-9645

Mukund Sheth
Financial Advisor
www.pyramidfinancial.ca
mukund@pyramidfinancial.ca

Serving at 2 locations
GTA East / GTA West ON LIC # 10530

Investment | Insurance | Mortgages

પરદેશમાં દેશની મહેક એટલે

સ્વદેશ

કેનેડાથી પ્રસિદ્ધ થતું સર્વોત્તમ ગુજરાતી સાપ્તાહિક SWADESH



યુરોપમાં પૂરપ્રકોપ : 33નાં મોત, 70 લોકો લાપતા

PAGE NO. 9

FRIDAY, 16 JULY, 2021 Vol. 18, No. 29 Pages 20 Tel: 416-996-7755, E-mail : info@swadesh.news Web : www.swadesh.news

પૂર્વ રાષ્ટ્રપતિની ધરપકડ બાદ હિંસાનો દોર

આફ્રિકામાં 72થી વધુના મોત, ભારતીયોની સંપત્તિની તોડફોડ

દ. આફ્રિકામાં ફૂડ સપ્લાય ચેન પર પણ હિંસાની અસર : લોકોએ જરૂરી વસ્તુઓ ખરીદવા માટે લાઈનો લગાવી



જહોનિસબર્ગ

દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમાની ધરપકડ બાદ હવે આ દેશના સંખ્યાબંધ શહેરોમાં ભારે હિંસા ફાટી નીકળી છે. હિંસા એટલી હદે બેકાબૂ બની છે કે, તેમાં ૭૨ લોકોના મોત થઈ ચુક્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, હિંસા પર ઉતરેલા પૂર્વ રાષ્ટ્રપતિના સમર્થકો ભારતીય મૂળના લોકોને નિશાન બનાવી રહ્યા છે. તેમના ઘરો અને દુકાનો લૂંટવામાં આવી રહી છે. તોફાનો સતત શોપિંગ મોલ્સને નિશાન બનાવી રહ્યા છે.

હિંસાને કારણે દક્ષિણ આફ્રિકામાં ફૂડ સપ્લાય ચેન પર પણ હિંસાની અસર પડી છે. લોકોને ખાવા પીવાની વસ્તુઓ ખરીદવા માટે લાંબી કતારો લાગી રહી છે. બીજી તરફ અહીંયા રહેતા ભારતીય મૂળના લોકો ભારત સરકાર પાસે સોશિયલ મીડિયા પર મદદ માંગી રહ્યા છે. એક ભારતીયે લખ્યું હતું કે, નાટલ તેમજ જોહાનિસબર્ગમાં ભારતીયોને

ટાર્ગેટ કરાઈ રહ્યા છે. દક્ષિણ આફ્રિકામાં ૧૪ લાખથી વધારે ભારતીય રહે છે. તમામ પર ખતરો નથી પણ કેટલાક વિસ્તારોમાં ચોક્કસપણે જોખમ છે. સાઉથ આફ્રિકાની સરકાર પાસે મદદ માંગી છે પણ કોઈ મદદ મળી નથી.

દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે વ્યાપક હિંસા પર ચિંતા વ્યક્ત કરી છે અને સાથે સાથે દક્ષિણ આફ્રિકાની સરકાર સાથે પણ વાત કરી છે. જયશંકરની અપીલ બાદ દક્ષિણ આફ્રિકાના વિદેશ મંત્રી નલેદી પંડોર તરફથી ભારતીયોને સુરક્ષાનો ભરોસો આપવામાં આવ્યો છે.

વર્ષ 2009થી 2018 સુધી દક્ષિણ આફ્રિકામાં જેકબ ઝુમાની સરકાર હતી, જેના પર ગુમા બંધુઓનો ખાસ પ્રભાવ હતો. આ દરમિયાન ઝુમા અને તેમની સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. આ માટે હવે દક્ષિણ આફ્રિકામાં ઝુમાના સમર્થકોને લાગે છે કે ઝુમાના જેલ જવા પાછળ ગુમા બંધુઓનો હાથ છે. આ માટે જ તે ભારતીય મૂળના લોકોને નિશાન બનાવી રહ્યા છે.

કોરોનાનું વધુ ખતરનાક સ્વરૂપ વિશ્વને જોવા મળી શકે: WHO

દુનિયામાં કોરોનાની લહેરનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો

લંડન

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની ઈમરજન્સી કમિટીએ ગુરુવારે આપેલી ચેતવણી મુજબ, રોગચાળાનું અત્યાર સુધી જે સ્વરૂપ જોયું છે, તે તો માત્ર ટ્રેલર છે અને ભવિષ્યમાં તે વધુ ખતરનાક તસવીર બતાવી શકે છે. WHO એ કહ્યું છે કે આગામી સમયમાં કોરોનાના નવા વેરિયન્ટ્સ દુનિયાભરમાં ફેલાય તેવી સંભાવના છે, જે રોગચાળાને ખતમ કરવાનું વધુ મુશ્કેલ બનાવી શકે છે.

સમિતિએ જણાવ્યું કે, “રોગચાળો હજી સમાપ્ત થવાનો નથી. એવી સંભાવના છે કે વૈશ્વિક સ્તરે વધુ ખતરનાક વેરિયન્ટ્સ ફેલાઈ શકે છે, જેને નિયંત્રણમાં રાખવા વધુ પડકારજનક હશે. અત્રે ઉલ્લેખનિય છે કે અત્યાર સુધીમાં દુનિયાભરમાં કોરોનાનાં કારણે

40 લાખથી વધુ લોકોનાં મોત થયા છે, કોરોના વાયરસ સતત તેનું સ્વરૂપ બદલી રહ્યું છે અને તેનો ડેલ્ટા વેરિયન્ટ હાલમાં મોટાભાગના દેશોમાં કહેર મચાવી રહ્યો છે. ભારતમાં બીજી લહેર માટે જવાબદાર મનાતો આ વેરિયન્ટ કોરોનાનું મૂળ સ્વરૂપ એટલે કે આલ્ફા વેરિયન્ટ કરતા વધુ સંક્રમક છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના પ્રમુખ ટેડ્રોસ અધનોમે ચેતવણી આપી છે કે દુનિયા કોરોના વાયરસની ત્રીજી લહેરની શરૂઆતના તબક્કામાં પહોંચી ગયું છે. દુનિયાભરમાં ડેલ્ટા વેરિયન્ટના કહેરની વચ્ચે WHO પ્રમુખે આ તાજી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે દુર્ભાગ્યવશ આપણે કોરોનાની ત્રીજી લહેરના શરૂઆતના તબક્કામાં પહોંચી ગયા છીએ. તેમણે કહ્યું કે ડેલ્ટા વેરિયન્ટ હવે દુનિયાના 111થી વધુ દેશોમાં પહોંચી ગયો છે.

SUPER VISA INSURANCE

Get Full REFUND if visa is declined
Get partial refund if parents leave early*
*conditions apply.... Ask NOW for a free quote..



Sanjiv Puri
Insurance Broker
Ph.: 416-890-3232
Email: sanjivpuri@rogers.com

StarLife
Insurance & Investments Inc.
www.starlifeinsurance.ca

LIFE INSURANCE | FUNERAL INSURANCE | MORTGAGE INSURANCE | CRITICAL ILLNESS INSURANCE | DISABILITY INSURANCE
SUPER VISA INSURANCE | INSURANCE FOR VISITORS / NEW IMMIGRANTS | RESP | ESTATE PLANNING | RRSP | RETIREMENT PLANNING



કેનેડામાં વસતા મુસ્લિમ બિરદારોને 'સ્વદેશ પરિવાર' તરફથી ઈદ-ઉલ-અદહા પર્વની હાર્દિક શુભકામના

ABOWATH REAL ESTATE GROUP

MAAZ ABOWATH
BROKER
416 893 4585
More Info on PAGE 2 વધુ માહિતી પાનું 2 પર

ABOWATH.COM

છેલ્લા ૪૪ વર્ષથી ટોરાન્ટોની સર્વ પ્રથમ ગુજરાતી ટ્રાવેલ એજન્સી. ૪૪ વર્ષથી ગુજરાતી પ્રજા અને ગુજરાતી ભાષા અમારી સફળતા માટે યજ્ઞભાગી છે. દિલથી આપનો અમે ખૂબજ આભાર માનીએ છીએ. સ્વાઈ મુસાફરી ની ટીકીટ માટે અમારા ભાવ ટોરાન્ટોમાં ખૂબજ આકર્ષક છે અજમાવી જુઓ... આપને આનંદ થશે.

Ashok Travels 416-977-9896 અશોક ટ્રાવેલ્સ ૪૧૬ ૯૭૭ ૯૮૯૬

Thank you for your continued support since last 44 years. We are glad to be your family travel agency and we feel proud to serve three generations with most competitive prices and excellent service.

www.ashoktravel.com
Ashok Travels Serving your travel needs in Canada since 1973
TICO # 1486999 238 Gerrard St. East, Suite 100 Toronto, ON M5A 2E8

✓ Residential
✓ New Condos
✓ Investments
✓ Commercial

દુઆમાં યાદ રાખશે
Zakir Patel
Broker
Cell: 416-561-7973
Office : 416-287-2222



RE/MAX COMMUNITY
Realty Inc., Brokerage
Independently Owned and Operated
1265, Morningside Ave. #203
Toronto, ON M1B 3V9
Email : patelzakir82@gmail.com



- REAL ESTATE
- LITIGATION
- WILLS AND ESTATES
- AFFIDAVIT AND POWER OF ATTORNEY
- NOTARIZATION
- FAMILY LAW
- CORPORATION / COMMERCIAL TRANSACTIONS
- FRANCHISE CLOSING

Avni Shah
B.A., JD
Barrister & Solicitor

ashah@sslawyers.ca
Tel : 416-818-4000
Fax : 416-740-4002

1780 ALBION ROAD, UNIT # 8, TORONTO ONTARIO M9V 1C1



10 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પૈકી 3ને 10 વર્ષમાં PR મળશે

ઓન્ટેરિયો

વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરવાનું પસંદ કરી રહ્યાં છે અને કેનેડાની સરકાર પણ તેમનામાં આશાસ્પદ માનવબળ જોઈ રહી છે. ઈમિગ્રેશન, રેફ્યુજિસ એન્ડ સિટીઝનશીપ કેનેડા (આઈઆરસીસી) ના જણાવ્યા મુજબ વર્ષ 2019 અને 2020 દરમિયાન કેનેડામાં સ્ટડી પરમિટ ધરાવનારાઓની સંખ્યા 122,000થી વધીને 142,400 થઈ ગઈ છે. વર્ષ 2020 પછી કેનેડામાં આવનારા દર 10 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પૈકી ત્રણને 10 વર્ષમાં કેનેડાના પરમેનન્ટ રેસીડન્ટનું સ્ટેટસ

મળી શકશે.

સ્ટેટેસ્ટીકસ કેનેડાના અહેવાલ મુજબ અડધાથી વધુ માસ્ટર્સ ડિગ્રી સ્ટુડન્ટસ છે અને 10 પૈકી 3 પાસે ડોક્ટરલ ડિગ્રી સ્ટુડન્ટનું સ્ટેટસ છે, જેમને આ ગાળામાં પરમેનન્ટ રેસીડન્ટનું સ્ટેટસ મળી શકશે. જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ નોન યુનિવર્સિટી પોસ્ટ સેકન્ડરી એજ્યુકેશન હેઠળ નોંધણી ધરાવે છે તેમને પણ આવરી લેવાશે. જેમણે 2010થી 2018 વચ્ચે નોંધણી કરાવી હોય, તેમની સંખ્યા 2000થી 2008 દરમિયાન નોંધાયેલા કરતાં બમણી હશે. ચોક્કસ વિષયોના નોન યુનિવર્સિટી પોસ્ટ સેકન્ડરી એજ્યુકેશન માટે નોંધણી

વધુ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટસ કેનેડીયન ઈમિગ્રન્ટસ બનવા માંડ્યા

કરાવનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું પ્રમાણ પણ વધુ છે. એનો અર્થ એવો થાય છે કે, જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કેનેડામાં પોસ્ટ સેકન્ડરી એજ્યુકેશનના આશયથી આવે છે, તેમને પરમેનન્ટ



રેસીડન્સી મળવાની શક્યતાઓ પણ વધુ છે. 2010થી 2018 દરમિયાન પહેલી સ્ટડી પરમિટ મેળવનારાઓનું પ્રમાણ લગભગ 85 ટકા છે. જેમાં મોટાભાગે તો ભારતના વિદ્યાર્થીઓ છે,

પછીના ક્રમે 30 ટકા સાથે નાઈજીરિયા છે અને 29 ટકા સાથે વિયેટનામ છે. જે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે અહીં કામ પણ કરતા હોય, તેમને પરમેનન્ટ રેસીડન્ટ બનવાની શક્યતાઓ વધુ હોય છે. જેનું પ્રમાણ લગભગ 50 ટકા છે. એમાં પણ વાર્ષિક આવકને ધ્યાનમાં રાખીએ તો વર્ષ 2000થી 2008 દરમિયાન સ્ટડી પરમિટ મેળવનારાની આવક વર્ષે 40000 યુએસ ડોલર કે વધુ હોય એવા લગભગ 17 ટકાને પરમેનન્ટ રેસીડન્ટનું સ્ટેટસ મળે છે. જેમને વર્ષે 20000 યુએસ ડોલરથી ઓછો પગાર હોય તેમના પૈકી 85 ટકાને એ મળે છે.

કોરોના વાયરસથી ગભરાટ યથાવત, મહત્તમ કેનેડીયનોને પ્રવાસમાં ખચકાટ

એર કેનેડાએ વિશ્વભરના 11 સ્થળો માટે 17 રૂટોની ફ્લાઈટ્સ શરૂ કરવાની તૈયારી દર્શાવી

ટોરોન્ટો

પૂર્ણ રીતે વેકસીનેટેડ હોય એવા કેનેડીયન્સ અને પરમેનન્ટ રેસીડન્ટ્સ માટે પ્રવાસ પ્રતિબંધોમાં છૂટછાટની જાહેરાતને પગલે એર કેનેડાએ વિશ્વભરના 11 સ્થાનો માટેની 17 રૂટોની ફ્લાઈટ્સ શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. આ સમાચાર ત્યારે આવ્યા છે જ્યારે પ્રવાસ વિશેનો

એક સરવે પણ સામે આવ્યો છે. જેમાં જાણવા મળે છે કે, ઘણાં કેનેડીયનો હજુ દૂરના પ્રવાસ માટે તૈયાર નથી.

કેટલાકે વેકેશન માટેના પ્રવાસનું બુકિંગ કરાવ્યું છે. પણ એ બધા જ ઉનાળાના વેકેશનમાં પોતાના ઘરથી નજીકના પર્યટન સ્થળે જવાનું પસંદ કરે છે. સર્વેક્ષણમાં ભાગ લેનારાઓ પૈકીના પોણાભાગના લોકોએ કહ્યું હતું કે, હજુ ત્રણ માસ સુધી તેઓ કોઈ એવા પ્રવાસનું આયોજન નહીં કરે, જેમાં ઘરથી વધુ દૂર રહેવાનું હોય. એટલે લંડન કે પેરીસ જવાને બદલે કાલગેરી કે હેલીફક્સ જવાનું પસંદ કરશે. હજુ વેકસીનેશન ચાલી

રહ્યું છે અને વધુને વધુ લોકો વેકસીન લઈ રહ્યાં છે. જેઓ વિદેશ પ્રવાસ વિશે વિચારી શકશે. આ સર્વેક્ષણ હાથ ધરનારી વેબસાઈટ ફ્રિન્ડર ડોટકોમ સાથે સંકળાયેલા નિકોલ મેકનાઈટ કહે છે કે, એક વાત સ્પષ્ટ છે કે, વિદેશ પ્રવાસ માટે હજુ મોટાભાગના કેનેડીયનોના મનમાં ખચકાટ છે. ફ્રાઈન્ડરના સર્વેમાં 13 ટકા લોકોએ સ્થાનિક પ્રવાસનું આયોજન પણ ત્રણ માસ પછી કરવાની જ વાત કરી હતી. માત્ર સાત ટકાએ જ વિદેશ પ્રવાસની તૈયારી દર્શાવી હતી. જ્યારે માત્ર બે ટકાએ જ સ્થાનિક અને વિદેશ પ્રવાસની તૈયારી દર્શાવી હતી.

જુલાઈના અંત સુધીમાં ટોરોન્ટોનો સીએન ટાવર ફરીથી ખુલ્લો મુકાશે

ટોરોન્ટો

ટોરોન્ટોમાં હવે બધું પહેલા જેવું થઈ રહ્યું હોય એવા સંકેતો ટોરોન્ટોના જાણીતા સ્થળ સીએન ટાવરને ફરીથી ખુલ્લો મુકવાની જાહેરાતથી મળી રહ્યાં છે. બુધવારે થયેલી જાહેરાત મુજબ સીએન ટાવર આ માસની 23મી તારીખથી મહેમાનો માટે શરૂ થઈ જશે. જે ઓન્ટેરિયોના રીઓપનિંગ પ્લાનના સમયપત્રક મુજબ જ હશે. જેમને મુલાકાત લેવામાં રસ હોય તેઓ મર્યાદિત ટીકીટો માટે બુકિંગ કરાવી ખરીદી શકશે. આ ટીકીટધારક ઓબ્ઝર્વેશન ડેક પર જઈ શકે છે. એ જ વોક માટેનું બુકિંગ પણ શરૂ થયું છે. જેમાં મુલાકાતીઓ ટાવરના મેન પોડની ફરતે ચાલી શકે છે અને રોમાંચ

માણી શકે છે. ટાવરની ટાચે આવેલી 150 ડિગ્રી રેસ્ટોરાં પણ 24મી જુલાઈથી શરૂ થશે. જેનું બુકિંગ પણ હવે શરૂ થઈ ચુક્યું છે. ઓન્ટેરિયોમાં કોવિડ-19ના પ્રતિબંધોને કારણે છેલ્લા મહિનાઓથી સીએન ટાવર બંધ હતો. પ્રાંતમાં ત્રણ તબક્કાના રીઓપનિંગ પ્લાનનો ત્રીજો ભાગ 23મી જુલાઈથી શરૂ થયો હોવાથી હવે ડાઈનીંગ, જીમ, મુવિથિયેટર શરૂ થઈ શકશે. સીએન ટાવરના કર્મચારીઓ કહે છે કે, એમનો રીઓપનિંગ પ્લાન પ્રાંતે ત્રીજા તબક્કામાં સફળતાથી પ્રવેશ કર્યો હોવાથી જ શક્ય બન્યો છે. હવે ટાવર દરરોજ સવારે 10.00 વાગ્યાથી રાત્રે 10.00 વાગ્યા સુધી ખુલ્લો રહેશે.

ભારતથી ડાયરેક્ટ ફ્લાઈટ પર કેનેડાનો પ્રતિબંધ: કોવિડ ટેસ્ટ સ્વીકારવા ઇન્કાર

ટોરોન્ટો

કોરોના વાઈરસ રોગચાળાને ધ્યાનમાં રાખીને કેનેડા સરકારે ભારતમાંથી આવતી ડાયરેક્ટ ફ્લાઈટ ઉપર 21 જુલાઈ સુધી પ્રતિબંધ મૂક્યો છે. જો કે આ સમયગાળા દરમિયાન જો કોઈ પ્રવાસી ભારતમાંથી કેનેડા આવવા માગતો હોય તો તેણે કેનેડા આવતાં પહેલાં કોઈ ત્રીજા દેશમાં થઈને ત્યાંથી કોવિડ નેગેટિવ રિપોર્ટ લઈને આવવાનું રહેશે, તેમ કેનેડા સરકારની લેટેસ્ટ ગાઈડલાઈન્સમાં જણાવાયું હતું. કેનેડા સરકારના આ આદેશનો અર્થ એવો થયો કે તેણે ભારતના કોવિડ ટેસ્ટને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. દેશની સત્તાવાર ટ્રાવેલ એડવાઈઝરીએ નોંધ્યું છે કે કેનેડા ભારતનો કોવિડ-19 મોલેક્યુલર ટેસ્ટ રિપોર્ટનો સ્વીકાર કરશે નહીં. તેને બદલે પ્રવાસીએ કેનેડામાં

આવતાં પહેલાં છેલ્લા ડિપાર્ચર સ્થાન પર કરવામાં આવેલ ટેસ્ટનો રિપોર્ટ પ્રસ્તુત કરવાનો રહેશે એડવાઈઝરીમાં ઉમેરવામાં આવ્યું હતું કે કેનેડાનો પ્રવાસ ચાલુ રાખતા પહેલાં ત્રીજા દેશમાંથી પુરાવો મેળવવાનો રહેશે અને ત્રીજા દેશમાં ઓછામાં ઓછા 14 દિવસનું રોકાણ કર્યું હોવું જરૂરી છે. દરમિયાન જે પ્રવાસીઓ કોરોના પોઝિટિવ જાહેર થયા હોય અને કેનેડા જવા માંગતા હોય તેવા લોકોએ ડિપાર્ચર અગાઉ 14થી 18 દિવસ વચ્ચે કરાવવામાં આવેલા પોઝિટિવ કોવિડ ટેસ્ટ રિપોર્ટને રજૂ કરવાનો રહેશે, તેમ એડવાઈઝરીમાં નોંધવામાં આવ્યું હતું. નવી એડવાઈઝરીમાં કેનેડા સરકારે તેના નાગરિકોને ભારતમાં ઉત્તરપૂર્વીય રાજ્યો અને જમ્મુ અને કાશ્મીરના બિનજરૂરી પ્રવાસને ટાળવાની સલાહ આપી છે.

હેલ્થ કેનેડાએ પ્રતિબંધિત કરેલા ગ્રાફીનયુક્ત માસ્કસના વેચાણને અંતે માન્યતા આપી

ટોરોન્ટો

હેલ્થ કેનેડાએ થોડા સમય પહેલા જ માસ્કસને આરોગ્ય માટે જોખમી ગણાવી બજારમાંથી પાછા ખેંચાવ્યા હતા, એની ચકાસણી કરનાર એજન્સીના અહેવાલ બાદ એવા માસ્કના વેચાણને માન્યતા આપી હતી. આ અગાઉ એપ્રિલમાં જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં ગ્રેફીન કે બાયોમાસ ગ્રેફીનયુક્ત માસ્કસના વેચાણને અટકાવી દેવાનો આદેશ કર્યો હતો. હવે તે માસ્કની ચકાસણી બાદ એજન્સીનો અહેવાલ એવો આવ્યો હતો કે, આવા માસ્કથી આરોગ્યને નુકસાન નથી થતું. એને ધ્યાનમાં રાખીને હેલ્થ કેનેડાએ પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. ગ્રેફીનમાં સિંગલ લેયર

કાર્બનના અણુઓ હતા. જે નેનો મટીરીયલ ગણાય છે. એ એન્ટી વાઈરસ અને એન્ટી બેક્ટેરીયલ ગુણો ધરાવે છે. એટલે હેલ્થ કેનેડાએ એને મંજૂરી આપી હતી. જો કે, એજન્સીની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે, જો આવા ગ્રેફીનઅણુઓ શ્વાસથી શરીરમાં જાય તો તે ફેફસાંને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ વધુ તપાસ બાદ એ શક્યતા નહીંવત જણાતા આ નિર્ણય લેવાયો હતો. ગુરૂવારે જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકામાં હેલ્થ કેનેડાએ સ્પષ્ટ કર્યું હતું કે, માસ્કમાં વપરાતું નવું મટીરીયલ ગ્રેફીનયુક્ત હોય તો પણ એનાથી કોઈ નુકસાન પહોંચતું નથી. એટલે શેન્ગોંગ શેન્ગકવન મટીરીયલને માન્યતા આપવામાં આવી છે.

STAR LEGAL SERVICES

Lawyers and Licensed Paralegal
Ankita Patel & Abdul Bala
Immigration Experts

416-750-2900 | WWW.starlegal.ca

INSURANCE SERVICES

- LIFE INSURANCE • DISABILITY INSURANCE
- HEALTH, DENTAL & DRUG INSURANCE
- SUPER VISA & VISITOR VISA INSURANCE
- FUNERAL INSURANCE

INVESTMENT SERVICES

- RESP • RRSP • TFSA • PENSION PLANS
- NON REGISTERED INVESTMENTS

ADDITIONAL SERVICES

- ESTATE PLANNING • WILLS • HEALTH CARE DIRECTIVES
- BUSINESS TAX STRATEGIES

REFERENCE BASED SERVICES

- MORTGAGES

PERSONAL TAX SERVICES

CORPORATION TAX SERVICES -BOOKKEEPING SERVICE

KIRAN PATEL

FINANCIAL ADVISOR

647-608-5238

203-2680 Lawrence Ave. East,
Toronto, ON M1P 4Y4.

કેનેડા સરહદ ખુલ્લી મુકવા અમેરિકામાં માંગ

યોગ્ય નિર્ણય માટે રાજકીય દબાણ ઉભુ કરવા કોન્ફરન્સમાં ધારાસભ્યોના સુચનો

વોશિંગ્ટન : કેનેડા અને અમેરિકા વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાના હિમાયતીઓએ ફરી એકવાર બંને દેશો વચ્ચેની સરહદ પરથી પ્રતિબંધો હટાવી લેવાની માંગણી કરી હતી. કેનેડીયન અમેરિકન બિઝનેસ કાઉન્સિલના સીઈઓ સ્કોટી ગ્રીનવુડે એ અંગેની રજૂઆત કરતા કહ્યું હતું કે, વેકસીનેટેડ પ્રવાસીઓ માટે આ પ્રતિબંધો હટાવી લેવા જોઈએ. આ રજૂઆત સમયે મિડવેસ્ટર્ન લેજિસ્લેટીવ કોન્ફરન્સમાં ભાગ લેનારા ડેલીગેટ્સ પણ હાજર હતા. વાર્ષિક બેઠકની આ કોન્ફરન્સમાં એ વિશેનો ઠરાવ સર્વાનુમતીથી પસાર કરવામાં આવ્યો હતો, જેમાં કેનેડા અને અમેરિકાના સત્તાવાળાઓને અનેક સુચનો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત એવા નિર્ણય માટે રાજકીય દબાણ ઉભુ કરવાની વિનંતી પણ કરવામાં આવી હતી. એમ પણ જણાવવામાં

આવ્યું હતું કે, આવશ્યક સેવાઓ કે વ્યાપારની વ્યાખ્યા બરાબર સમજાય એવી રાખવી જોઈએ. એની બધી સત્તા માત્ર સરહદ પરના અધિકારીને ન અપાવી જોઈએ.

આ કોન્ફરન્સે અમેરિકા અને કેનેડાની ફેડરલ સરકારો સમક્ષ પણ રજૂઆત ટૂંક સમયમાં કરવાની તૈયારી દર્શાવી હતી. એને માટે વેકસીનેશન ઝુંબેશને વેગ આપવા પણ વિનંતી કરશે.

આ સાથે જ જણાવ્યું હતું કે, કેનેડા સીધા વિદેશી રોકાણનું બીજા ક્રમનું સ્રોત છે અને અંદાજે પાંચ લાખથી વધુ રોજગારો પણ પુરા પાડે છે. બંને દેશો વચ્ચેનો કૃષિ વ્યવસાય પણ મહામારી પહેલા ૪૮ બિલીયન યુએસ ડોલર જેટલો હતો. બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પણ સરહદ જલદીથી ખુલ્લી મુકાય એ જરૂરી બને છે.

કેનેડાના બેરીમાં વાવાઝોડું ફુંકાતા નુકસાન



કેનેડાના બેરીના દક્ષિણ વિસ્તારમાં ગુરૂવારે સાંજે ભારે વરસાદ બાદ વાવાઝોડું ફુંકાયું હતું. જેને કારણે વાહનો પલટી મારી જવા ઉપરાંત અનેક ઘરોને નુકસાન થયું હતું. 10 થી 15 મિનિટ સુધી ચાલેલા વાવાઝોડાને કારણે સાયરન વાગતા લોકોમાં અકરા-તકરીનો માહોલ સર્જાયો હતો. હવામાન વિભાગે પણ વાવાઝોડાની પુષ્ટિ કરી હતી. વાવાઝોડાને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીજપુરવઠો ખોટકાઈ જતા લોકોને મુશ્કેલીમાં મુકાવું પડ્યું હતું.

બ્રિટીશ કોલંબિયાના કેલોવાનામાં મહામારીમાં દુપ વર્ષથી ઓછી વયના લોકોના કેઈન દુર્ઘટનામાં ૪ કામદારના મોત મોતનું કારણ દવાનો ઓવરડોઝ અથવા શરાબ

44 વર્ષથી ઓછા વયજુથમાં શરાબ સેવનથી 2019માં 325 અને 2020માં 480 મોત થયા

બ્રિટીશ કોલંબિયા
આરસીએમપીના જણાવ્યા મુજબ સોમવારે બ્રિટીશ કોલંબિયાના કેલોવાનામાં બનેલી કેઈન દુર્ઘટનામાં ચાર જણાનાં મોત ઘટના સ્થળે જ થયા હતા. આ ઉપરાંત એકનું અન્ય કાટમાળ નીચે દટાઈને મૃત્યુ થયું હોવાની આશંકા છે. જો કે, પોલીસે આ વાતની જાણકારી મંગળવારે પત્રકાર પરિષદમાં આપી હતી. આરસીએમપીના ઈન્સપેક્ટર આદમ મેકેન્ટોશે કહ્યું હતું કે, આ ઘટના સોમવારે સવારે ૧૦.૪૫ કલાકે બની હતી. જયારે એક નવા મકાનનું કામ ચાલતું હતું. ત્યારે ત્યાંની કેઈન જ તૂટી પડી હતી. જેનો એક હિસ્સો બાજુની બિલ્ડિંગમાં

આવેલી એક ઓફિસ અને વૃધ્ધોનાનિવાસ પર પડ્યો હતો. કેઈનનો ચાલક પણ માર્યા ગયેલા કામદારોમાં હોવાનું પોલીસ માની રહી છે. જયારે મરણ પામનારની સંખ્યા પાંચ હોવાની આશંકા છે. જેમાં પાંચમો વ્યક્તિ બાજુની ઓફિસમાં કામ કરનારો હતો અને એને આ મકાનના કામ સાથે કોઈ લેવા દેવા નહોતી. ઘટનાની જાણ થતાં જ મંગળવારે સૌથી પહેલા ત્યાં પહોંચનારી પહેલી નિષ્ણાંતોની ટીમ વાન્ટુવરથી આવી હતી. દટાયેલા ગુમ વ્યક્તિના શરીરને બહાર કાઢવાનો પ્રયાસ આ ટીમે કર્યો હતો. આ ટીમમાં ફાયર ફાઈટર્સ, તબીબી, પોલીસ અને એન્જનીયર્સનો સમાવેશ થતો હતો.

ટોરોન્ટો
સોમવારે સ્ટેટકેન દ્વારા જાહેર કરાયેલા અહેવાલમાં કોવિડ-૧૯ મહામારીને કારણે લાંબા ચાલેલા લોકડાઉન દરમિયાન થયેલા ઓવરડોઝ અને શરાબ સેવનને કારણે થયેલા મૃત્યુના આંકડાઓમાં ચોંકાવનારી બાબત સામે આવી હતી. આંકડાઓ મુજબ દુપ વર્ષથી ઓછી વયના મૃતક કેનેડીયનોનું પ્રમાણ માર્ચ ૨૦૨૦ અને એપ્રિલ ૨૦૨૧ દરમિયાન ૫૫૩૫ જેટલું નોંધાયું હતું. આ સમયગાળામાં જ કોવિડને

કારણે થયેલા મૃત્યુના આંક પણ આ જ વયજુથમાં વધુ હતો. અહેવાલમાં એમ પણ જણાવ્યું હતું કે, કેટલીકવાર તો આ આંકડા કોવિડ-૧૯ને કારણે થનારા મૃત્યુથી પણ વધુ હતા. ખાસ કરીને નાની વયના કેનેડીયનોમાં એ જોવા મળ્યું હતું. ૪૪ વર્ષથી ઓછા વયજુથમાં શરાબ સેવનને લગતા મૃત્યુ ૨૦૧૯માં જે ૩૨૫ હતા, એ ૨૦૨૦માં વધીને ૪૮૦ થયા હતા. એ રીતે જ ૪૫થી ૬૪ વર્ષના વયજુથમાં પણ આ આંકડા વધુ જોવા

મળ્યા હતા. શરાબ સેવનને કારણે થતા મૃત્યુમાં રોગ અને સ્થિતિ અને શરાબનું વધુ પ્રમાણમાં સેવનને જ ધ્યાનમાં રખાયા હતા. એમાં કાર અકસ્માતને ગણતરીમાં લીધા નહોતા. વળી આ પ્રકારના મૃત્યુ સ્ત્રી અને પુરૂષ બંનેમાં જોવા મળ્યા હતા અને એમાં પણ લીવર સંબંધિત રોગોનો પ્રભાવ વધુ જોવા મળ્યો હતો. તેમજ એ લોકોની માનસિક સ્થિતિ કે વર્તનમાં વિચિત્રતા પણ કારણરૂપ હતી.

બ્રિટીશ કોલંબિયાની વધુ એક નિવાસી શાળા પાસેથી ૧૬૦ કબરો મળ્યાનો દાવો

વાનકુવર
ફર્સ્ટ નેશનના અહેવાલ મુજબ બ્રિટીશ કોલંબિયાની વધુ એક નિવાસી શાળાની નજીકથી ૧૬૦થી વધુ લોકોની અજાણી કબરો મળી આવી છે. પહેલા જે કુપર આઈલેન્ડ તરીકે ઓળખાતો હતો એ પેનેલાકુટ આઈલેન્ડમાંથી એક નિવાસી શાળા નજીકથી અજાણ્યા લોકોની ૧૬૦થી વધુ કબરો મળી આવી હોવાનો દાવો પેનેલાકુટ જાતિના વડા જોઆન બ્રાઉને સોમવારે એક ઓનલાઈન નિવેદનમાં કર્યો હતો. ચેમેનિયસ નજીકના કાંઠે આવેલો નાનો ટાપુ કુપર આઈલેન્ડ ઈન્ડસ્ટ્રીયલ સ્કુલ ધરાવતો હતો. જેનું સંચાલન ૧૮૮૦થી ૧૯૭૫ સુધી કેથોલિક સંસ્થા સંભાળતી હોવાના પુરાવા છે. આ લોકોએ જ આપણા જાતિભાઈઓને મારીને દફનાવી દીધા હોઈ શકે, એવી

શક્યતા પણ નિવેદનમાં વ્યક્ત કરાઈ હતી. કેમકે આસપાસના વિસ્તારમાંથી જ આ શાળામાં ભણવા વિદ્યાર્થીઓ આવતા હતા. એ બધા પોતાના ઘરે પાછા નથી ફરી શક્યા એનું દુખ છે. આવા સામુહિક હત્યાકાંડો માફીને પાત્ર નથી. વળી એ માનવાધિકારોનું હનન પણ કરે છે. આમ છતાં એનાથી બચવું જરૂરી છે. સમય જતા વાગેલા ઘા રૂઝાઈ શકે છે, પણ હંમેશા માટે આવા ઘા રૂઝાતા નથી. કેમ કે, એનો બોજો ઘણો વધુ હોય છે. આ તપાસ બહાર આવ્યા બાદ પેનેલામુટ જાતિએ આઈલેન્ડ ઉપર બે સત્ર યોજીને લોકોને રાહત આપવાનું આયોજન કર્યું છે. આવનારા અઠવાડિયાઓમાં આ કાર્યક્રમ યોજાશે. માર્ચમાં નાના બાળકો માટેનું સત્ર પણ યોજાશે એમ પણ જાતિના વડાએ કહ્યું હતું.

THINKING OF INVESTING?

INVEST AS LOW AS \$50,000 IN REAL ESTATE

SECURED INVESTMENT with up to 8-12% Guaranteed Return

INVEST WITH **Metrobuild Capital**
Sharia'h Compliant

We have multiple avenues for investment in Residential Properties, Commercial Properties or Construction Projects **plus** your investment is secured against the assets.

રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટી અથવા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ માં અમારી પાસે ઘણાં જુદા જુદા રોકાણોનો વિકલ્પ છે જ્યાં તમને રોકાણ પર ૮-૧૨% સુધીનું વળતર અને તમારું રોકાણ સંપત્તિ સામે સુરક્ષિત હોય છે.

CALL 416 893 4585 TODAY!!!

આપના વિશ્વાસુ અને ભરોસાપાત્ર
અમારી રીયલ એસ્ટેટ અને ઇન્વેસ્ટમેન્ટની મફત સલાહ નો લાભ ઉઠાવવા માટે આજે જ સંપર્ક કરો.

Call us TODAY for all of your Real Estate Needs and get Honest, Reliable and Courteous Service you can count on.

- ✓ Residential
- ✓ New Construction
- ✓ Investment
- ✓ Commercial

416 893 4585

ABOWATH

REAL ESTATE GROUP

VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

ABOWATH.COM

RE/MAX CROSSROADS REALTY INC. #SellwithABOWATH your Local REALTOR

*Not intended to Solicit client under contract.

LIFE INSURANCE
MORTGAGE/LINE OF CREDIT INSURANCE

Q : DO YOU HAVE MORTGAGE / LINE OF CREDIT INSURANCE WITH BANK ?
A : COMPARE & SAVE UP TO 50% LOWEST RATES GUARANTEED

AGE	\$ 250,000		\$500,000		\$1000,000	
	Male & Female	Male & Female	Male & Female	Male & Female	Male & Female	Male & Female
30 Yrs	\$ 12.00	\$ 07.00	\$ 18.00	\$ 10.00	\$ 32.00	\$ 19.00
40 Yrs	\$ 13.00	\$ 08.00	\$ 22.00	\$ 14.00	\$ 36.00	\$ 26.00
50 Yrs	\$ 30.00	\$ 18.00	\$ 50.00	\$ 31.00	\$ 95.00	\$ 60.00
60 Yrs	\$ 85.00	\$ 56.00	\$ 146.00	\$ 103.00	\$ 271.00	\$ 190.00

ALSO AVAILABLE

- ★ NO MEDICAL TEST LIFE INSURANCE (up to age 85)
(Even if you have DIABETES, BLOOD PREASURE, HEART ATTACK, STROKE)
CANCER OR INSURANCE declined by other companies
- ★ CORPORATION OWNED LIEF / CRITICAL ILLNESS INSURANCE
(Key Person INSURANCE, BUY SELL AGREEMENT, GROUP BENEFITS)
- ★ MONEY BACK LIFE / CRITICAL ILLNESS INSURANCE, RRSP, RESP, TFSA

Visitor To CANADA INS, TRAVEL INS, Lite ins For Refugees & Work Permits
Email : - Davindersingh1@gmail.com
www.financialhuttd.com.

416.320.4614 Toll : 1866.623.0865 Call For HONEST ADVICE

SUPER VISA INSURANCE
HARD TO BEAT OUR PREMIUMS



Davinder Singh Chawla



તંત્રી સ્થાનેથી

અફઘાનિસ્તાનમાં તાલિબાનોની ફરતા, 22 જવાનોના ઢીમ ઢાબ્યા



તંત્રી - પ્રકાશક સ્વદેશ

અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈન્યએ સૌથી મોટું થાણું બગરામ બેઝ ખાલી કરી દીધું છે. અમેરિકાના જવાનોએ આફઘાનિસ્તાનની ભૂમિ છોડવાની શરૂઆત કરી કે તરત જ બેઝમાં લૂંટફાટ થવા માંડી છે. વળી, બગરામના અફઘાની બેઝ કમાન્ડર પણ અમેરિકી પલાયનથી અજાણ હતા. હવે અમેરિકન જવાનો વાહનો સમેત ૨૫ લાખથી વધુ સંખ્યામાં શસ્ત્રસરંજામ મૂકતા ગયા છે. જેથી તાલીબાનોએ તેનો ઉપયોગ કરવા માંડ્યો છે. અમેરિકી પ્રમુખ બિડેને અગાઉ ૩૧ ઓગસ્ટ, ૨૦૨૧ સુધીમાં આખું અમેરિકી સૈન્ય અફઘાનિસ્તાનમાં ખાલી કરી દેશે તે બાબતની ઘોષણા કરી હતી. આજે મોટાભાગના નાટો અને અમેરિકી સૈનિકો પોતાને દેશ પાછા ફરી ચૂક્યા છે. અમેરિકી પ્રમુખ નફ્ટાઈથી કહી ચૂક્યા છે કે, અમેરિકા અફઘાનિસ્તાનમાં રાષ્ટ્ર-નિર્માણ માટે નહોતું ગયું અને અફઘાનીઓએ તેમનું ભવિષ્ય જાતે નક્કી કરવાનું રહેશે. હવે અમેરિકાએ આફઘાનિસ્તાનમાં રસ ઓછો કરતા દિવસેને દિવસે તાલિબાન દ્વારા એક પછી એક પ્રદેશો કબજે કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ ફરી તાલિબાનોનો કૂર ચહેરો દુનિયાની સામે આવી રહ્યો છે.

તાલિબાનોએ શરણે આવેલા અફઘાનિસ્તાનની સેનાના ૨૨ જવાનોને લાઈનસર ઊભા રાખી ગોળીઓનો વરસાદ વરસાવીને મારી નાખતા હાહાકાર મચ્યો છે. આ ૨૨ જવાનો તાલીબાનીઓ સમક્ષ કરગરતા રહ્યા કે, અમને ગોળી ન મારતા, અમને માફ કરી દો., પરંતુ તાલિબાનોએ આ જવાનોની કોઈ વાત સાંભળી નહીં અને મશીનગનોમાંથી ગોળીઓ વરસાવીને તમામ જવાનોનો મોતમે ઘાટ ઉતારી દીધા. તાલિબાનોએ હજી પણ અફઘાનિસ્તાનના સૈનિકોને ધમકી આપી છે કે, તમારે જીવતા રહેવું હોય તો સરન્ડર કરી દો ! અફઘાનિસ્તાનમાંથી હજુ તો અમેરિકાની સેના પૂરેપૂરી હટી નથી ત્યાં જ તાલિબાનો ખૂંબાર ખેલ ખેલવા માંડ્યા છે. તેથી આગામી દિવસોમાં આ હિંસા વધુ ભીષણ બનશે.

તાલિબાનોએ તો તુર્કીને પણ ચેતવણી આપી દીધી છે કે, અફઘાનિસ્તાનમાંથી તમારા સૈનિકોને ખસેડી લો. તાલિબાનો કાબુલ તરફ આગળ વધી રહ્યાં છે. તાલિબાનોએ આવું કરીને અફઘાનિસ્તાનની સેનાના જવાનોને સંદેસ આપવા માંગે છે કે, તમારા પણ એ જ હાલ થશે જે સીરીયામાં આઈએસઆઈએસે તેના વિરોધી લોકોના કર્યા હતા. તાલીબાનીઓએ માત્ર તુર્કી જ નહીં, પરંતુ પાકિસ્તાનને પણ કહી ધીધું છે કે, તમારી મર્યાદામાં રહેજો. પાકિસ્તાન ભલે તાલિબાનોના આવવાથી ખુશ હોય, પણ અંદરખાને તો પાકિસ્તાનને પણ ડર છે કે, તાલિબાનો ક્યાંક પાકિસ્તાનના વિસ્તારો કબજે કરવા ન માંડે!

તાલિબાનો અત્યારથી જ એવી રીતે વર્તવા લાગ્યા છે, જાણે અફઘાનિસ્તાનમાં એમની સત્તા આવી ગઈ હોય. તાલિબાનોના પ્રતિનિધિઓ રશિયાની મુલાકાતે ગયા હતા અને અફઘાનિસ્તાન વતી વાટાઘાટ કરી હતી. ઈરાન જઈને પણ તાલિબાનોએ સંબંધો વિશે ચર્ચા વિચારણા કરી છે. બીજી તરફ અફઘાનિસ્તાનના નેતાઓ હવે સ્વીકારી રહ્યા છે કે, અફઘાનિસ્તાનમાં લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. અમેરિકા અમને અલ્લાહના ભરોસે છોડીને ચાલ્યું ગયું છે. અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હમીદ કરજઈએ બળાપો ઠાલવતા કહ્યું છે કે, અમેરિકા તેના મિશન અફઘાનિસ્તાનમાં

સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયું છે.

બીજી તરફ અમેરિકાનું કહેવું છે કે, અમે આખી જિંદગી આફઘાનિસ્તાનને કઈ રીતે નિભાવી ન શકીએ. વીસ વર્ષથી અમે આફઘાનિસ્તાનની તો તમને સાચવી રહ્યા હતા. અમેરિકાએ જ્યારે તાલિબાનો સાથે સમાધાન કર્યું ત્યારે ખાતરી લીધી હતી કે, તાલિબાનો અફઘાનિસ્તાનમાં અલ-કાયદા કે બીજાં કોઈ આતંકવાદી સંગઠનોને પનાહ નહીં આપે. જો કે, વાસ્તવિકતા એ છે કે, અફઘાનિસ્તાનમાં બીજા કોઈની જરૂર જ ક્યાં છે ? તાલિબાનો ખુદ જ આતંકવાદીઓ છે.

અફઘાનિસ્તાનના લોકો પર ધાક બેસાડવા પણ તેઓએ ફરતા આચરવી પડશે. તાલિબાનોએ એવો ડર ફેલાવી દેવો છે કે, કોઈ તેની સામે અવાજ ઉઠાવવાની હિંમત ન કરે. તાલિબાનોએ પોતાની લડાઈને જેહાદનું નામ આપ્યું છે. તાલિબાનના પ્રવક્તા આમિર ખાન મુત્તાકીએ કહ્યું છે કે, હવે તાલિબાનોની લડાઈ પહાડો અને રણ પુરતી મર્યાદીત નહીં રહે. આ લડાઈ શહેરો સુધી પહોંચી ગઈ છે. શહેરોની ગલીઓમાં પણ લડાઈ થાય તેવું અમે ઈચ્છતા નથી. તેથી વાતચીતના માધ્યમથી યોગ્ય રસ્તો કાઢવા પ્રયાસ કરાસે. આમિર ખાન મુત્તાકીના આ વાક્યનો સીધો અર્થ એ છે કે, હવે અમને અફઘાનિસ્તાન સોંપી દો.

તાલિબાનોએ ૧૯૯૦માં અફઘાનિસ્તાન પર કબજો જમાવતી વખતે જે પદ્ધતિ અપનાવી હતી, આજે પણ તેનું જ પુનરાવર્તન કરી રહ્યા છે. અફઘાનિસ્તાનની સ્થિતિ ઉપર ભારતની પણ નજર છે. હાલ કંદહારમાં આવેલા ભારતીય વાણિજ્ય દૂતાવાસને બંધ કરી દેવાયું છે. ત્યાંના કર્મચારીઓને પાછા બોલાવી લેવાયા છે. જલાલાબાદ અને હેરાતમાં આવેલા ભારતીય દૂતાવાસ તો ૨૦૨૦માં જ બંધ કરી દેવાયા હતા. કાબુલ અને મઝાર-એ-શરીફમાં હજુ ભારતીય દૂતાવાસ કાર્યરત છે. સંજોગો વણસ્યા તો આ બંને દૂતાવાસોના કર્મચારીઓને પાછા બોલાવી લેવાય તેમ છે.

આ સિવાય અફઘાનિસ્તાનના અલગ અલગ પ્રોજક્ટો પર ભારતના ૧૭૦૦ નાગરિકો કામ કરી રહ્યા છે. ભારતે હાલમાં એ બધાને સતર્ક રહેવા સૂચના જારી કરી છે. ગૃહ યુદ્ધની સ્થિતિમાં એ લોકોને તાત્કાલિક ત્યાંથી લઈ આવવાની પણ તૈયારી કરી દેવાઈ છે. જો કે, તાલિબાન નેતા ફીદ મામુન્દજઈએ કહ્યું છે કે, અમે એવું નથી ઈચ્છતા કે, કોઈ દેશ પોતાની એમ્બેસી બંધ કરી દે. જો કે, આમ છતાં દુનિયાના દેશોને અફઘાનિસ્તાનમાં કામ કરતા પોતાના લોકોની ચિંતા થવા માંડી છે. માત્ર ભારત જ નહીં, રશિયાએ પણ મઝાર-એ-શરીફ ખાતેનું દૂતાવાસ બંધ કરી દીધું છે. ચીને પણ અફઘાનિસ્તાનમાંથી પોતાના ૨૧૦ નાગરિકોને પાછા બોલાવી લીધા છે. ઉત્તરી અફઘાનિસ્તાનમાં તાલિબાની મુજાહિદીન વિરુદ્ધ હાર્યા બાદ અફઘાની રાષ્ટ્રીય સેનાના હજારો સૈનિકો પાડોશી દેશ તાજિકિસ્તાન પહોંચી ગયા અથવા તો તાલિબાનને શરણે થયાની ખબરો આવી છે. જેનું કારણ અમેરિકાની પીછેહઠ બાદ અમેરિકી સૈન્ય તાકાતના જોરે ટકેલા અફઘાની સૈનિકોનું તૂટેલું મનોબળ ઉપરાંત કેટલાય મહિનાઓથી ન મળેલો પગાર ગણાવાઈ રહ્યાં છે. તાજિકિસ્તાન તરફ પલાયન કરી રહેલા અફઘાની સૈનિકોએ ત્યજી દીધેલાં હમવી અને રેન્જર જેવાં અમેરિકી બખ્તરિયા વાહનો હવે તાલિબાનીઓના કબજામાં છે. અફઘાન નેશનલ આર્મીના કેટલાય સૈનિકો અને અધિકારીઓ તેમના અમેરિકી બનાવટના અત્યાધુનિક શસ્ત્ર-સરંજામ સાથે તાલિબાનમાં ભળી ચૂક્યાની પણ વાતો વહેતી થઈ છે.

manoj1968@yahoo.ca

RE/MAX
REALTY SERVICES
 INC., BROKERAGE
 INDEPENDENTLY OWNED AND OPERATED

JAY PATEL
 BROKER

 647.241.3818
 jaypatel1323@gmail.com

"Let Me Make Your Dream Home Into A Reality"
Residential, Commercial & Investment in Real Estate

 Off : 905.456.1000 | Fax : 905.456.1924
 295 Queen Street East, Brampton, On., L6W 3R1

ARISTO PEST CONTROL
 Set your mind at rest, we will get rid of the pest

647-339-3926 | aristopest@gmail.com | www.aristopestcontrol.com


 ✓ Mice
 ✓ Rat

SAME DAY SERVICE - RESIDENTIAL, COMMERCIAL, INDUSTRIAL

 ✓ Cockroach
 ✓ Bedbug
 ✓ Animal Control

WE SPEAK ENGLISH, GUJARATI & HINDI

 ✓ Bird Control
 ✓ WASPS and
 ✓ Hive Removal

24 HRS / 7 DAYS EMERGENCY SERVICES AND ANIMAL REMOVAL

We also provide No Obligation Inspection for Commercial and Residential Clients.

Written Guarantee And Discounted Rates

CALL SANKET TRIVEDI - 647.339.3926
 Government Licensed Structural Exterminator

ગોવર્ધન થાળ

સ્વાદિષ્ટ શુદ્ધ શાકાહારી ગુજરાતી ભોજન

Weekend Special

રગડા પેટિસ, પાંઉભાજી,
છોલેપુરી, કટલેસ,
ખાસ્તા ક્યોરી,
સેવ ઉસળ, સમોસા ચાટ

Takeout & Catering

Limited થાળી
(with sweet & Farsan)

\$8.00 +Tax

Limited થાળી
(without sweet & Farsan)

\$6.50 +Tax



CATERING SPECIAL

\$ 7.99 10 items

+Tax

Sweet, Farsan, Subji,
Kathor, Puri, Dal, Rice
Papad, Pickle, Kachumber

Franchise
Opportunity
in GTA

Call us for details

રસોઈકામ
કરી શકે તેવા
બહેનોની જરૂર છે.

ફોન નં: ૪૧૬-૪૩૮-૦૫૪૪

૪૧૬-૫૨૦-૨૯૨૨, ૪૧૬-૪૩૪-૮૧૨૧

૯૪૦, મારખમ રોડ, સ્કારબોરો, ઓન્ટેરીયો, કેનેડા, M1H2Y2

દેશ-વિદેશથી ટોરન્ટો ભણવા આવતા ગુજરાતી
(વેજીટેરીયન) સ્ટુડન્ટ, ભાઈઓ તથા બહેનોની ખાસ
સગવડ માટે તુષાર શાહ તથા ગોવર્ધન થાળ શરૂ કરે છે

ગુજરાત ભવન

જેમાં આપને સ્પેશિયલ રૂમ, શેરીંગ રૂમ, ગુજરાતી વેજીટેરીયન ભોજન,
પ્રાઈવેટ બેડ, Wi Fi ઇન્ટરનેટ વગેરે સગવડો આપવામાં આવશે.



ગુજરાત ભવન

Quarantine
Special
Package

\$73 Per Day



Call : Tushar Shah - 416-434-8121

ગુજરાત ભવન - 416-913-7184

4694 Kingston Road, Scarborough.



રાજકોટમાં બોગસ પેઢી ઊભી કરી રૂપિયા 115 કરોડની કરચોરીનું કૌભાંડ આચરાયું

13 સ્થળોએ ડીજીજીઆઈએ દરોડા પાડ્યા, દસ્તાવેજો જપ્ત કર્યા, 1ની ધરપકડ

રાજકોટ


બોગસ પેઢીઓ ઊભી કરીને તેનાં નામે વ્યવહારો કરી કરોડો રૂપિયાની ઈનપુટ ટેક્સ કેડિટ લેવાનાં કરોડોનાં કૌભાંડો બહાર આવી રહ્યા છે. રાજ્ય સ્તરે ૧૦૦૦ કરોડનું કૌભાંડ બહાર આવ્યા બાદ રાજકોટમાં એક બોગસ પેઢી ઊભી કરીને આશરે રૂ. ૧૧૫ કરોડની કરચોરી કરવાનું કૌભાંડ સેન્ટ્રલ જીએસટીની એન્ફોર્સમેન્ટ વીંગે ઝડપી પાડ્યું છે.

જીએસટી લાગુ પડ્યા બાદ તેના

ઈંડા શોધી મોટા પાયે કરચોરી કરવામાં આવી રહી છે. કોરોના હળવો પડતા જીએસટીની જુદી જુદી વીંગ સક્રિય બની છે. સેન્ટ્રલ જીએસટી હેઠળ આવતા ડીજીજીઆઈ વીંગ દ્વારા રાજકોટની સ્કેપ અને પ્લાસ્ટીંગનું વેચાણ કરતી એક પેઢી જે.પી. એન્ટરપ્રાઇઝનાં વ્યવહારો ચકાસવામાં આવ્યા હતા. શહેરમાં ૧૩ સ્થળોએ દરોડા પાડી કેટલાક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. આ તપાસમાં આશરે રૂ. ૧૧૫ કરોડની કરચોરી

કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. જે વસ્તુ વેચાઈ કે ખરીદાઈ નથી તેના બોગસ બીલોનાં આધારે કરચોરી કરવામાં આવતી હતી. બોગસ કંપનીને નામે વ્યવહારો કરવામાં આવતા હોવાનું તપાસમાં ખુલ્લું છે. ઊંડી તપાસમાં કરચોરીનો આંકડો હજુ મોટો બહાર આવે તેવી શક્યતા છે. રાજકોટનાં મવડી વિસ્તારમાં આવેલી આ પેઢીનાં મુખ્ય સુત્રધારની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજુ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દ્વારકા મંદિરની બાવન ગજની ધ્વજ પર વીજળી પડી, ધ્વજાંડને નુકસાન



ભારે વરસાદને પગલે દ્વારકા જગત મંદિરની બાવન ગજની ધ્વજ પર વીજળી પડતા ધ્વજાના ડંડાને નુકસાન થયું હતું. કેટલાક ભક્તોએ તો આ બાબતને પણ સમત્કાર જ ગણાવી દીધી હતી. દ્વારકા જગત મંદિર વિસ્તારમાં મંગળવારે પડેલા વરસાદને કારણે મંદિર આસપાસ તથા સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થઈ જતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવાની નોબત આવી હતી.

રાજકોટમાં સિવિલની બેદરકારી, 25 દર્દીઓને દવાનું રીએક્શન થયું

રાજકોટ : રાજકોટ સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં ઘેરાયેલી રહી છે બુધવારે બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવતા ફરી એક નવો વિવાદ ઊભો થયો છે. ઓપીડી વિભાગનાં છઠ્ઠા માળે આવેલા સર્જરી વિભાગમાં આજે સવારે દર્દીઓને દવાઓ અપાયા બાદ એકાએક રીએક્શન આવતા બે બાળકો સહિત ૨૫ દર્દીઓનાં જીવ જોખમમાં મુકાયા હતા. એકાએક દર્દીઓની તબીયત લથડતા પરિવારજનોએ હાજર તબીબો - સ્ટાફને જાણ કરવા છતાં ન આવતા ભારે હોબાળો મચી ગયો હતો. તાત્કાલિક દવાઓ અને સાધનો સીલ કરી આ ઘટનાની એડીઆરને તપાસ સોંપવામાં આવી છે. સર્જરી થઈ હોય અને બાકી હોય તેવા દર્દીઓને આ વોર્ડમાં સારવાર અપાઈ રહી છે.

મોતીતળાવના યુવાનની હત્યા કેસમાં ત્રણને આજીવન કારાવાસની સજા ત્રણ વર્ષ પૂર્વે છરીના ઘા ઝીંકી કરાઈ હતી યુવાનની હત્યા

ભાવનગર

ભાવનગરના અલ્કા ટોકીઝ પાસે ત્રણ વર્ષ પૂર્વે મિત્રની હત્યા કેસમાં જામીન પર જેલ બહાર આવી વડવા વિસ્તારના શખ્સોએ મોતીતળાવના યુવાનને છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખી હતી. મળતી માહિતી મુજબ મોતિતળાવ વિસ્તારમાં આવેલ કાદરી મસ્જીદવાળા ખાંચામાં રહેતા તોફાંકભાઈ અહેમદભાઈ મન્સુરીએ જે-તે સમયે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેઓના નાનાભાઈ રિયાઝભાઈના મિત્ર સમસેરભાઈ ચૌહાણનું

બાપસરા કુવા પાસે હત્યા થઈ હતી જે હત્યા કેસમાં સંડોવાયેલ સાજીદ અબ્દુલસતારભાઈ દસાડીયા, એજાજ ઉર્ફે મુંગો અહેમદભાઈ કુરેશી અને તોફાંક ઉર્ફે કાળુ ખાલીદભાઈ શેખે જામીન પર છુટ્યા બાદ તેના ભાઈ રીયાઝભાઈ સાથે સામુ જોવા અને કતરાવા બાબતે બોલાચાલી કરેલ તેની દાઝ રાખી તમામે ગુનાહિત કાવતરૂ રચી અલ્કા ટોકીઝ પાસે જીવલેણ હુમલો કરી છરીના ઘા ઝીંકી રીયાઝભાઈની હત્યા કરી નાખી હતી. જે મામલે નિલમબાગ પોલીસે તમામ સામે ગુનો દાખલ કર્યો હતો.

આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં રાજકોટના વિદ્યાર્થીને એવોર્ડ

રાજકોટ : આમેરિકામાં ન્યુયોર્ક સ્ટેટમાં જીનીયસ ઈન્ટરનેશનલ ઓલિમ્પિયાડમાં વિશ્વના ૮૪ દેશોના ૨ હજાર વિદ્યાર્થીઓએ જુદા-જુદા ૧૨૪૫ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. જેમાં રાજકોટમાં બે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જે પૈકી ધોળકિયા સ્કૂલના ધો.૮ ના વિદ્યાર્થી સુજલ ભુવાએ ઓનરેબલ મેન્શન એવોર્ડ મેળવી રાજકોટનું ગૌરવ વધાર્યું હતું. ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં ખેડૂતો સ્માર્ટ ફાર્મિંગ દ્વારા મબલખ ઉપજ મેળવી શકે છે. ટેકનોલોજીની મદદથી વાવેતરને નિયમિત પાણી મળી રહે તેવી કામગીરી ખેતરે ગયા વિના ખેડૂત ઘરે બેઠા મોબાઇલ ફોનની મદદથી કરી શકે છે. ખેતીની સમગ્ર પ્રક્રિયાને આધુનિક ટેકનોલોજીની મદદથી સહેલી બનાવી શકાય છે. તેવા સ્માર્ટ ફાર્મિંગના ધો.૮ના વિદ્યાર્થી સુજલ ભુવાના પ્રોજેક્ટનો આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર થયો હતો.

THANK YOU FRONTLINE WORKERS



MORTGAGE DILIGENT
A STEP AHEAD

FSRA # 10252

⇒ Purchase ⇒ Refinance ⇒ Renewal/Switch

5 Yrs Fixed @ 1.84%* High Ratio Only
5 Yrs Variable @ 1.15%* High Ratio Only
3 Yrs Variable @ 0.99%* (Special Promotion)



Rakesh Patel**
Vice President- Commercial.



Pranay Jani *



Nilesh Tailor *



Bala Shah*



Vijay Rana*



Rajesh Khurana, MBA
Principal Broker

Cell : 416-616-1300

Tel.: 289 521 6900

1305 Matheson Blvd E, Mississauga ON L4W 1R1

• info@mortgagediligent.com • www.mortgagediligent.com

Rates are subject to change without notice.* FSCO#10252,OAC,E&O.E * - Mortgage Agent, ** - Vice President

* Some conditions apply

નવસારીમાં ભાઈની હત્યાનો બદલો લેવા ભાજપના માજી પ્રમુખની હત્યા

નવસારી

નવસારી શહેરના ઘેલખડી વિસ્તારમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાય ગયો હતો. રીક્ષામાં બેસીને આવેલા 6 ઈસમો એક યુવાન ઉપર તીક્ષ્ણ હથિયારો લઈ તૂટી પડ્યા હતા. અને તેની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. સરાજાહેર થયેલી હત્યાની આ ઘટનાને પગલે ટાઉન પોલીસ સહિત લોકલ કાર્ટમ બ્રાન્ચની ટીમ દોડતી થઈ ગઈ હતી.

નવસારી શહેરના ઘેલખડી વિસ્તારમાં શૈલેષ પરમાર નામના એક યુવાનની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી 6 ઈસમો ફરાર થઈ ગયા હતા. લોહી લુહાણ હાલતમાં રસ્તા ઉપર જ ઢળી પડેલા યુવાનને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. પરંતુ તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું. હત્યા ના બનાવ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પરંતુ તે પહેલા હત્યારા ફરાર થઈ ચૂક્યા હતા. સમગ્ર હત્યા પ્રકરણ માં અન્ય એક હત્યાની જૂની અદાવત કારણભૂત હોવાનું સામે આવ્યું હતું. વર્ષ 2017માં આજ

ઘેલખડી વિસ્તારના યુવાનોના બે જૂથ વચ્ચે ગરબા રમવા બાબતે મારામારી થઈ હતી. જેમાં નિલેશ વનમ નામના એક યુવાનનું ઢીમ ઢાળી દેવાયું હતું. અને તે હત્યામાં શૈલેષ પરમારનું નામ ખુલતા તેને જેલની હવા ખાવી પડી હતી. જોકે બાદમાં શૈલેષે નિલેશ વનમના પરિવાર જોડે સમાધાન કરી લેતા તે જેલમાંથી બહાર આવ્યો હતો. પરંતુ નિલેશ વનમનો ભાઈ ઉમેશ પોતાના ભાઈને મોતને ઘાટ ઉતારનાર હત્યારા શૈલેષને માફ કરી શક્યો ન હતો. તેના મનમાં બદલાની આગ ભભૂકી રહી હતી. અને તે સતત બદલો લેવા માટે યોજના બનાવતો રહેતો હતો. દરમિયાન તેને મોકો મળતા જ પોતાના સાથીદારો સાથે ઘેલખડી ખાતે પહોંચી ગયો હતો. અને ત્યાં શૈલેષ પરમાર ઉપર ઘાતકી હુમલો કરી તેની હત્યા કરી પોતાનું વેર વાળી લીધું હતું. સમગ્ર પ્રકરણમાં ટાઉન પોલીસ મથકમાં છ ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો. જે હત્યારાઓને ઝડપી પાડવા પોલીસ કામે લાગી હતી. હાલ પોલીસે છ પૈકી ચાર આરોપીઓને દબોચી લીધા છે.

જેમ એન્ડ જ્વેલરીની જૂનમાં નિકાસ વધી રૂ. 20851 કરોડ થઈ

સુરત

દેશની જેમ એન્ડ જ્વેલરીની નિકાસ ફરી તેના કોરોના મહામારીના સમય પહેલાંના સ્તરે પહોંચી છે. જૂન 2021માં રૂ. 20851 કરોડ નિકાસ થઈ છે. નિકાસમાં 4 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. કોરોના મહામારી પહેલા જૂન 2019માં નિકાસ રૂપિયા 19891 કરોડની હતી. જ્યારે એપ્રિલથી જૂન દરમિયાન કોરોના મહામારી પહેલાં 2019માં કુલ નિકાસ રૂપિયા 62018 કરોડ હતી, તેની સરખામણીમાં આ જ સમયગાળા દરમિયાન 2021માં નિકાસ રૂપિયા 67265 કરોડ થઈ છે. નિકાસમાં 8.42 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. બીજી લહેર વખતે માર્ચ પહેલાં હીરા ઉદ્યોગમાં કામકાજને ખૂબ જ ખરાબ થઈ અસર થઈ હતી, અને તેની અસર નિકાસ કામકાજ ઉપર પણ જોવાઈ હતી. જોકે એપ્રિલથી બજાર સુધરતા નિકાસ કામકાજમાં પણ સુધારો આવ્યો છે.

સુરતમાં નગ્ન ફોટા પાડીને મિત્રની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધ્યા

વિવિધ હોટલોમાં લઈ જતી 14 મહિના સુધી યૌન શોષણ

સુરત

સુરતમાં એક મિત્રએ પોતાના મિત્રની પત્ની સાથે કરેલા કૃત્યને ભારે ચક્ર્યાર જગાવી છે. ડુંભાલમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાનની 32 વર્ષીય દેખાવડી પત્નીને જોઈને પતિના મિત્રની નજર તેના પર બગડી હતી. વેસુમાં રહેતો પતિનો આ મિત્ર પણ કન્સ્ટ્રક્શનનું કામ જ કરતો હતો. આ યુવાને મિત્રની પત્નીને સોફ્ટ ડ્રિન્કમાં નશીલો પદાર્થ પીવડાવી તેના નગ્ન ફોટા પાડી લીધા હતા. બાદમાં ફોટો પરિણીતાને બતાવીને સતત દોઢ વર્ષ સુધી દબાણ કરી ધમકી આપી હતી.

ધમકીથી તે યુવાને પરિણીતાને અલગ અલગ હોટલમાં લઈ જઈને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. નગ્ન ફોટોને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી સતત દોઢ વર્ષ સુધી પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો હતો. જો કે, વારંવારની હેરાનગતિથી કંટાળેલી પરિણીતાએ

આખરે પોતાના પતિને સમગ્ર હકિકતથી વાકેફ કર્યો હતો. ત્યારબાદ દંપતીએ પોલીસનું શરણું લેવાનો નિર્ણય કરીને પુણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદને આધારે વેસુ નંદિની-૩માં રહેતા 37 વર્ષીય જીગર વિજય મહેતાને પકડવા ક્વાયત આદરી હતી. જો કે, આરોપી ફરાર થઈ ગયો હતો. ડુંભાલ વિસ્તારમાં રહેતી અને બે સંતાનોની માતા એવી ૩૨ વર્ષીય પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે જીગરે વેસુ અને પીપલોદની ઓયો રૂમ અને કાસા બ્લાન્કા તથા વિવિધ હોટલમાં રૂમમાં લઈ જઈ સતત 14 મહિના સુધી યૌનશોષણ કર્યું હતું.

તેના પતિનું જ્યાં કન્સ્ટ્રક્શન સાઈડ ચાલતી હતી ત્યાં જ વેસુ નંદિની-૩માં રહેતા જીગર વિજય મહેતાની સાઈડ ચાલતી હોવાથી 2019માં તેની સાથે પરિચય થયો હતો. પતિના નંબરમાંથી જીગરે પરિણીતાનો નંબર મેળવી લીધો હતો અને રોજ સવારે ગુડ મોર્નિંગના મેસેજ કરતો હતો.

ઘઉં-ઉલ-અદલા મુબારક

અલ્લાહ આપને ઘઉં-ઉલ-અદલાના મુકદ્દસ

અવસર પર તમામ ખુશીઓ

આપે અને આપની કુર્બાની કબુલ કરે



Salma Zahid

MP for Scarborough Centre
5-2155 Lawrence Avenue East
Scarborough, ON M1R 5G9

Tel. (416) 752-2358

Fax (416) 752-4624

salma.zahid@parl.gc.ca
salmazahid.libparl.ca

f SalmaZahid15

@SalmaZahid15



Imperial PEST CONTROL

Residential • Commercial • Industrial

24 Hour Service • 7 Days a Week



Preventing the Spread of COVID-19 :
Our disinfectant services that we offer are:

1 Spray Services 2 Fogging Services 3 Sanitation Services

All Pest Control:

Mouse & Rats, Cockroaches, Bedbugs,
Silver Fish, Spiders & Fleas, Carpenter Ants.
Total Interior & Exterior Pest Control

Removal:

Bees & Wasps, Pigeon, Squirrels, Raccoon,
Skunk, Nest & Hive, Hornests, Yellow Jackets

First Time Customer gets
10% Off
on your first home service
*Mention this offer while booking

Free Estimates &
Written Guarantee

Special Service For Bedbug Control

www.imperialpestcontrol.ca
info@imperialpestcontrol.ca
(We speak English, हिन्दी, ગુજરાતી)

Call: Ramesh Kanani 416-837-1820



સ્વદેશ CANADA

Registration # 869127209
Publication Mail Agreement /
Email : info@swadesh.news

WWW.SWADESH.NEWS

Return Undeliverable Canadian Address To :

Shree Balaji Inc.

MAILING ADDRESS

23 Lyric Road,
Brampton ON L6S 0B4.
416-996-7755

Registered Address

713, Markham Road, Scarborough M1H 2A8.

Editor & Publisher : Manoj Gandhi

Director : Nilesh Tailor

Sub Editor : Chhaya Gandhi

Montreal Bureau : Vijay Patel (514-826-7442)

GUJARAT OFFICE MAC AGENCIES : F-9, Jolly Square, Ram Chowk,
Ghod-Dod Road, Surat - 395 001. GUJARAT (INDIA)

Designed By

Sabir Daroga

Mevada Piyush

Firoz Shaikh

Disclaimer : Swadesh is a weekly newspaper published by Shree Balaji Inc. in Gujarati Language. The opinions expressed in Swadesh may not be those of the publisher. Contents of this publication are covered by copyright and offenders will be prosecuted under the law.



દાહોદમાં પ્રેમી સાથે ભાગનાર પરિણીતાને નિર્વસ્ત્ર કરી ઢોર માર માર્યો: 14 પકડાયા

દાહોદ

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજૂરી ગામે રહેતી એક પરિણીતા પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જેની અદાવત રાખી પતિ અને સાસરિયાઓ તેમજ ગ્રામજનો દ્વારા પરિણીતા અને તેના પ્રેમીને પકડી લાવ્યા હતા. બાદમાં બંનેને ઢોર માર મારી પરિણીતાની ખેંચતાણ કરી તેના કપડાં ફરી નિર્વસ્ત્ર કરી દેવામાં આવી હતી. ઉપરાંત પરણિતાના ખભા ઉપર તેના પતિને બેસાડી ગામમાં તેને ફેરવી હતી.

તા.૧૨મી જુલાઈના રોજ બનેલી ધાનપુર તાલુકાની ઘટના પ્રકાશમાં આવી હતી. જે ઘટનામાં સડોવાયેલા ૧૮ સામે ગુનો દાખલ કરાયો છે. જે પૈકીના ૧૧ આરોપીની ધરપકડ કરાઈ છે. જ્યારે પાંચ આરોપીઓ ફરાર થયા છે. જેમની શોધખોળ માટે પોલીસની ટીમ કામે લાગી ગઈ છે. ધાનપુરમાં ખજૂરી ગામે મહિલા સાથે ઘુણાસ્પદ ઘટનાનો પડથો બુધવારે કેબિનેટની બેઠકમાં પડ્યો હતો. ગૃહમંત્રીએ આરોપીઓને ઝડપથી પકડીને દાખલો બેસાડવા પોલીસને સુચના આપતા

દાહોદના ગરબાડા અને ધાનપુર તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં કોમ્પિંગની ગતિ વધી હતી.

મહિલા અને બાળ સુરક્ષાની કચેરીની ટીમ દ્વારા પીડિતાનું કાઉન્સેલિંગ કરાયું છે. પીડિતાએ પોતાના પરિવાર સાથે રહેવાની ઇચ્છા દર્શાવતા પોલીસ દ્વારા હાલમાં તેમને રક્ષણ પણ પૂરૂ પડાયું છે. દરમિયાન, આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા ઉપર ચઢાવનારા તેમજ વાઈરલ કરનાર એકાઉન્ટ સામે પણ રિપોર્ટ કરવાની કાર્યવાહી થઈ છે.

ગાંધીનગરમાં આધુનિક રેલવે સ્ટેશન અને ફાઇવ સ્ટાર હોટલનું નિર્માણ



ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આકાર પામેલાં અદ્યતન રેલવે સ્ટેશન ઉપરાંત આધુનિક ફાઇવ સ્ટાર હોટલનું તા.16મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. 318 રૂમની ફાઇવ સ્ટાર હોટલ ગુજરાતનું નવલુ નજરાણુ બની રહેશે. આ ઉપરાંત સાયન્સ સિટીમાં ચ રૂ.405 કરોડના ખર્ચે નિર્માણ પામેલાં ત્રણ નવિન પ્રકલ્પોનું વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ ઉદઘાટન કરી ખુલ્લા મૂકશે.

વિરમગામમાં કાર્યક્રમમાં સોશિ. ડિસ્ટન્સના ભંગ બદલ 22 સામે ગુનો

વિરમગામ

વિરમગામ : કોરોના વાયરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે હાલ રાજ્ય સરકાર દ્વારા ૧૦-૭થી ૨૦-૭ સુધી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમ છતાં સરકારના જાહેરનામાનું ઉલ્લંઘન કરી ધાર્મિક શુભ પ્રસંગોની ઉજવણી કરી રહ્યા છે. વિરમગામ તાલુકાના વડગામ ગામે વીરદાદાના વધામણા પ્રસંગમાં ડીજી સાથે નાયતા ગાતા સેનેટરાઈઝની વ્યવસ્થા કર્યા વગર સોશયલ ડિસ્ટન્સ નહીં જાળવી અધિક જિલ્લા મેજ. અમદાવાદના જાહેરનામાનો ભંગ કરી ૨૨ જણ સામે વિરમગામ ગ્રામ્ય મથકે ગુનો નોંધી લાખો રૂપિયાનો મુદામાલ કબજે કરી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સ્વીટી ગુમ પ્રકરણ: હાડકા મળતાં અટાલીમાં પોલીસનું સર્ચ ઓપરેશન

વડોદરા

વડોદરા જિલ્લાના પીઆઈ એ.એ. દેસાઈના પત્ની સ્વીટીબેન ગુમ થવાના ચક્રાચરભર્યા બનાવમાં સળગી ગયેલા હાડકાના ટૂકડા મળ્યા બાદ પોલીસ દ્વારા આજે ફરી દહેજમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ દ્વારા ગત સપ્તાહમાં ત્રણ દિવસ સુધી દહેજના ૨૦ કિ.મી. વિસ્તારમાં શોધખોળ હાથ ધરાઈ હતી. પીઆઈ દેસાઈના મોબાઈલનું લોકેશન આ ૨૦ કિ.મી. વિસ્તારમાં દર્શાવાતું હોવાથી પોલીસ દ્વારા નદી, નાળા, અવાવરુ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં અટાલી



ગામ પાસે એક અવાવરુ બિલ્ડિંગમાંથી તેમજ નજીકમાંથી સળગી ગયેલા હાડકા મળ્યા હતાં. આ હાડકાના ટૂકડાનું સુરત ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટમાં ચકાસણી કરાવતા હાડકા માનવના હોવાનું જાણવા મળ્યું હતું. સળગી ગયેલા હાડકા મળતા પોલીસ દ્વારા હવે સ્વીટીબેનની હત્યા થઈ હોવાની આશંકા સાથે તપાસ આરંભાઈ છે. ફરીથી જિલ્લા પોલીસના અધિકારીઓએ સ્ટાફ સાથે જ્યાંથી હાડકા મળ્યા તે સ્થળ અને તેની આસપાસના વિસ્તારોમાં સર્ચ કર્યું હતું. જો કે કોઈ વસ્તુ પોલીસને મળી ન હતી.

વડોદરામાં બુલેટ ટ્રેન સ્ટેશન અને ટ્રેક માટે ટેન્ડર પ્રક્રિયાનો પ્રારંભ

વડોદરા

વડોદરા : અમદાવાદ-મુંબઈ વચ્ચે હાઈ સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) માટે ગુજરાતમાં જમીન સંપાદનથી લઈને બુલેટ ટ્રેન માટેનું નેટવર્ક ઉભુ કરવાની ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ તથા શહેરમાંથી પસાર થનારા ૮ કિ.મી.ના બુલેટ ટ્રેન ટ્રેક માટેના ટેન્ડરિંગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના છાણીથી વિશ્વામિત્રી વચ્ચે ૮ કિ.મી.ના રૂટ ઉપર હાઈ લેવલ બ્રિજ અને બુલેટ ટ્રેન ટ્રેક નિર્માણ માટે હજુ સુધી ટેન્ડરિંગ કરાયું નહતું. આ ઉપરાંત સયાજીગંજ વિસ્તારમાં તૈયાર થનાર બુલેટ ટ્રેન સ્ટેશન માટેની કામગીરી બાકી હતી જે હવે હાથ ધરવામાં આવી છે.

વડોદરામાં જવેલર્સની આંખમાં મરચું નાંખી લૂંટારૂ સોનાની ૩ ચેન ચોરી ગયો

વડોદરા

વડોદરામાં ન્યુ વીઆઈપીરોડ પર આવેલી ગીતાંજલી સોસાયટીમાં રહેતા રોનક સોની તેમજ તેમનો નાનોભાઈ શ્રીજી પ્લાઝા એપાર્ટમેન્ટમાં વલ્લભ જવેલર્સ નામની દુકાન ધરાવે છે. આજે સવારે ૧૦ વાગે બંને ભાઈઓએ દુકાન ખોલી હતી અને એકાદ કલાક પછી એક ગ્રાહકે આવીને મારા ફોઈ-ફૂઆની મેરેજ એનિવર્સરી છે અને મને તેમને ગિફ્ટ આપવાની હોવાથી સોનાની ચેન બતાવો તેમ કહેતા રોનકભાઈ ગ્રાહકને અલગ-અલગ ડિઝાઈનની ચેન બતાવતા હતાં. ગ્રાહકે બીજી ચેન બતાવવાનું કહેતા રોનકભાઈએ કેટલોગ બતાવ્યું હતું આ વખતે અગાઉ બતાવેલી ચેન કાઉન્ટર પરની ટ્રેમાં રાખી હતી. દરમિયાન બહારથી ટોપીવાળું જેકેટ તથા જીન્સ પેન્ટ પહેરેલ અને મોંઢા પર માસ્ક બાંધેલો એક યુવાન અચાનક



દુકાનમાં આવ્યો હતો અને બિસ્સામાંથી મરચાંની ભૂકી કાઢી રોનકભાઈના મોંઢા પર નાંખી કાઉન્ટર પર મૂકેલી ટ્રેમાંથી ૩.૫ તોલા વજનની રૂ.૧.૪૦ લાખ કિંમતની ત્રણ ચેનો લૂંટીને ભાગી ગયો હતો. આ વખતે નાનો ભાઈ દીપ લૂંટારૂને પકડવા જાય તે પહેલાં દુકાનમાં આવેલો લૂંટારૂ બહાર ઉભેલી એક બાઈક પર બેસી ભાગી ગયો હતો.

વેપારીને ઢોર માર મારવાના પ્રકરણમાં વડોદરામાં 2 પોલીસ કર્મચારી સસ્પેન્ડ

વડોદરા

વડોદરાના વડસર બ્રિજ પાસે કરફ્યુના સમય બાદ પાનનો ગલ્લો ખુલ્લો રાખનાર દુકાનદાર સામે કાર્યવાહી કરવાને બદલે માંજલપુર પોલીસ મથકના બે કોન્સ્ટેબલો દ્વારા ઢોર માર-મારવામાં આવ્યો હોવાની ઘટનામાં બંને પોલીસ જવાનોને ગણતરીના કલાકોમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલ કોરોનાને લઈને સરકાર દ્વારા રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. સરકારના આદેશ અનુસાર રાત્રી કફ્યુનું ચુસ્ત પાલન થાય તે માટે શહેર પોલીસ કમિશ્નર ડી. શમશેરસિંઘ દ્વારા પણ જાહેરનામું

બહાર પાડવામાં આવ્યું છે. જોકે કેટલીક હદે શહેરમાં રાત્રી કફ્યુનો અમલ થઈ રહ્યો છે. જ્યાં કફ્યુનો ભંગ થતો હોય ત્યાં પોલીસ કાયદાકીય કાર્યવાહી કરતી હોય છે. ખાખી વર્દિનો દૂર ઉપયોગ કરનાર માંજલપુર પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલો ઠાકોરભાઈ અને હરીશ ચૌહાણ કાયદાથી ઉપરવટ જઈ કરફ્યુનો ભંગ કરી પાનનો ગલ્લો ખુલ્લો રાખનારને મામાર્યો હતો. પોલીસ જવાનોના કરતુતના દ્રશ્યો સીસીટીવી કેમેરામા કેદ થયા છે. જે વિડીયો સોશિયલ મિડિયામાં વાયરલ થતા પોલીસ જવાનોની કામગીરી સામે લોકોએ રોષ ઠાલવ્યો હતો.



First Flight
FFCL Couriers Inc.

દુનિયાના કોઈપણ દેશમાં ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ મોકલવા માટે પણ સેવા ઉપલબ્ધ

તમારા ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ ઈન્ડિયા મોકલવા માટે સૌથી વ્યાજબી ભાવ અને સર્વશ્રેષ્ઠ સ્થળ

<p>1 LB \$20 વધુ દર LB ના \$6</p> <p>11 LB \$55 વધુ દર LB ના \$6</p> <p>23 KG \$185, વધુ દર KG ના \$10</p> <p>30 KG \$230, વધુ દર KG ના \$10</p>	<p>ખાવા-પીવાની વસ્તુ USA મોકલવા માટે FDA ની એપ્રુવલ અમે કરી આપીશું (Extra Charge)</p>	
--	--	--

જીટીએની સૌથી મોટી ઈન્ડિયન કુરિયર કંપની હવે તમારી સેવા માટે ત્રણ શાખાઓ

<p>Brampton (West) 519, Ray lawson boulevard , Unit-3, Brampton ON L6Y 0N2 Chandni Chowk Plaza, Opposite Vegetables Market. Phone 647-761-1317, 647-657-9631 -----: MON-THU : ----- 2.00 PM to 6.00 PM FRIDAY WEEKLY OFF : SAT-SUN : 1.00 PM to 6.00 PM</p>	<p>Scarborough WE ARE RE-OPENING 880 Markham Road, Unit-8 Main Intersection Markham Road & Painted Post, Near Saileela Khaman-Dhokla House Complex, Phone 647-761-1317 647-657-9631 905-673-9631 -----: MON-TUE : ----- 2.00 PM to 6.00 PM : SAT-SUN : 11.00 AM to 6.00 PM</p>	<p>Mississauga 2960 Drew Road, Unit-158, Mississauga ON L4T 0A5 Great Punjab Plaza, Next to Malton Gurudwara. : Phone : 905-673-9631 647-761-1317 647-657-9631 -----: MON-FRI : ----- 11.00 AM to 5.00 PM</p>
--	--	--

૬૪૭-૭૬૧-૧૩૧૭ www.firstflightcanada.com



કરીના કપૂરની બૂક 'પ્રેગનન્સી બાઈબલ' વિવાદમાં

બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન તાજેતરમાં જ લોન્ચ કરેલી પોતાની બૂકના કારણે મુશ્કેલીમાં પડી શકે છે. પોતાના બીજા પુત્ર જેહની પ્રેગનન્સી બાઈબલ કરીનાએ આ પુસ્તક લખ્યું હતું અને તેને પ્રેગનન્સી બાઈબલ નામ આપ્યું હતું. એક વ્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે ઓલ ઈન્ડિયા માઈનોરિટી બોર્ડ દ્વારા આ નામ સામે વાંધો ઉઠાવીને એક્ટ્રેસ સામે ફરિયાદ કરવાની યોજના બનાવાઈ રહી છે. બોર્ડના અધ્યક્ષ ડાયમંડ ચુસુફ્તુ કહેવું છે કે, પુસ્તકના પ્રેગનન્સી બાઈબલ નામ સામે વાંધો છે.



સ્પર્શ



નોરા ફતેહી આગામી ફિલ્મમાં રો એજન્ટની ભૂમિકા ભજવશે

પોતાના ગ્લેમરસ અંદાજના કારણે સૌથી વધુ ચર્ચામાં રહેનારી નોરા ફતેહી જ રિલીઝ થયેલા મુજબ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં જોવા મળવાની છે. જેનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મને ૧૩ ઓગસ્ટના રોજ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે, જે સત્યઘટના પર આધારિત છે. નોરા ફતેહી આ ફિલ્મમાં પાકિસ્તાનની એક ડાન્સરના પાત્રમાં જોવા મળવાની છે. જે વાસ્તવમાં ભારતની એક ખાનગી એજન્સી માટે કામ કરી રહી છે. નોરાનું પાત્ર એક રો એજન્ટનું છે અને પાકિસ્તાની સેનાની ખાનગી માહિતીઓ તે ભારતીય સેનાને મોકલતી રહે છે. નોરાનું આ ફિલ્મ રાજીમાં આલિયા ભટ્ટે ભજવેલું હતું તેવું જ હોવાનું કહેવાય છે. આ બંને પાત્રો એકબીજાને મળતા આવે છે. આ ફિલ્મ સત્યઘટના પર આધારિત છે, જોકે નોરાએ ભજવેલ પાત્ર વાસ્તવમાં એ મહિલા એજન્ટ કોણ હતી તે જાણવા મળ્યું નથી. સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, ફિલ્મ ભૂજમાં લીડ રોલમાં સોનાક્ષી સિંહા કામ કરી રહી છે. સેકન્ડ લીડ માટે ફિલ્મસર્જકે પરિણીતી ચોપરાની પસંદગી કરી હતી. પરંતુ તેને સોનાક્ષીના રોલની સરખામણીમાં પોતાનો રોલ ટૂંકો લાગ્યો હોવાથી તેણે કામ કરવાની ના પાડી હતી. આ પછી કૃતિ સેનન અને જેકલિન ફર્નાન્ડિસનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ આ બંને અભિનેત્રીઓએ પણ ઈનકાર કરી દીધો હતો.

દક્ષિણના અભિનેતા વિજયને લક્ઝરી કારનો ટેક્સ નહીં ચૂકવતા દંડ



સાઉથના ફિલ્મસ્ટાર થલપતિ વિજય તેમની લક્ઝરી કાર રોલ્સરોય પર વેરો ન ચૂકવવાને લઈને હાઇકોર્ટના ગુસ્સાનો ભોગ બન્યા છે. વિજય હાલમાં તેમની લક્ઝરી કાર રોલ્સ રોય ઘોસ્ટની ખરીદીના નવ વર્ષ પૂના કેસને લઈને મુશ્કેલ સ્થિતિમાં આવી ગયા છે. મદ્રાસ હાઇકોર્ટે તેમને એક લાખનો દંડ ફટકાર્યો છે. વિજય પર આરોપ છે કે તેમણે 2012માં તેમણે એક લક્ઝરી કારને લંડનથી મંગાવી હતી. આ કાર પર તેમણે વેરો ચૂકવ્યો ન હતો, જેના કારણે હાઇકોર્ટે તેમને એક લાખનો દંડ ફટકાર્યો છે. હાઇકોર્ટે સ્ટારની આ અપીલને ફગાવી દીધી છે અને જણાવ્યું હતું કે તે કચ વેવાથી ખરી રહ્યા છે. ન્યાયાધીશ એસ એમ સુબ્રમણ્યમે વિજયની અરજીને નકારી કાઢી હતી. કારની અંદાજિત કિંમત 6.95 કરોડથી 7.95 કરોડ છે. તેની પાસે આ ઉપરાંત પણ ઘણી મોંઘી કારો છે.

એ વખતે સતત જાકારો મળતો હતો: વિદ્યા બાલન

બોલીવૂડની ટિગ્ગજ અભિનેત્રીઓમાં સામેલ વિદ્યા બાલને અનેક હિટ ફિલ્મો આપતાં હવે તે એ કક્ષાએ બોલીવૂડમાં સતત જાકારો મળતો હતો. અહિં તેની ખુબ જ અવગણના થતાં તે એટલી હદે દુઃખી થઈ ગઈ હતી કે દરરોજ રાત્રે રડતાં રડતાં ઉઘી જતી હતી. તાજેતરમાં એક વેબસાઈટ સાથેની વાતચીતમાં વિદ્યાએ ખુલાસો કર્યો હતો કે ૧૯૯૫માં તેણે ટીવી સિરીયલ હમ પાંચથી અભિનય શરૂ કર્યો હતો. એ પછી છેક ૨૦૦૩માં બંગાળી ફિલ્મથી સિનેમામાં એન્ટ્રી કરી હતી. બોલીવૂડમાં વર્ષ ૨૦૦૫માં ફિલ્મ 'પરિણીતા' તેને મળી હતી. પરંતુ એ પહેલા તેને સતત રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. દારા પદાર્પણ કર્યું હતું. તે કહે છે ત્યારે હું બહુ નિરાશ થઈ જતી હતી. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ સતત અસ્વીકારનો સામનો કર્યો ત્યારે હું દરરોજ રાત્રે રડી પડતી હતી. મને લાગતું હતું કે હું કદી કલાકાર બનીજ નહિ શકું. પણ પછી દરરોજ સવારે હું સૂર્યના કિરણો જોઈને આશાને જીવીત રાખતી હતી.




PayLessTravel
Fly Well ... Pay Less

વિમાની સેવાના ભુકીંગ માટે એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ



Call for all your Air Travel Services

- Lowest Prices for Ahmedabad, Vadodara, Mumbai, Delhi
- We will beat or match any online price with better service, call once before booking online
- Best Service
- We sell Travel Insurance

Call us for the Lowest Fares Coming From India to Canada Also

Please Call 905-281-2627

Address : 100 Matheson Blvd. East, Unit-203, Mississauga, ON. L4Z 2G7

Get Updated travel information during COVID time



Tico # 50015262
tico.ca
Travel Industry Council of Ontario

GUARANTEED ACCESS TO PRE-CONSTRUCTION CONDOS IN DOWNTOWN TORONTO & GTA CALL ME NOW!

BUY • SELL • INVEST



Nadir Shah
100% Professional, 0% Attitude
Sales Representative
MBA, ACEA (UK)

416.625.3580
nadir.shah@sympatico.ca

4030, Sheppard Ave. East, Toronto, ON M1S 1S6
T: 416.291.0929 (24/7) F: 416.291.0984

CENTURY 21
Regal Realty Inc. Brokerage
Member Broker

Not intended to solicit buyers or sellers already under a contract.



॥ સંસ્કૃતિ ॥

હવે, સ્વદેશ વેબસાઈટના બદલાતા કલેવર

નિહાળો નીત નવા રૂપરંગમાં !!

માત્ર ગરવી ગુજરાત કે મેરા ભારત મહાન જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની અટારીએ સર્જાતી અનેકવિધ ઘટનાઓનો સાક્ષાત્કાર ક્ષણેક્ષણ માણો !!
રાજકારણ, સમાજ, ધર્મ, શિક્ષણ, રમતગમત, મનોરંજનનો મહાસાગર, હોલીવુડ-બોલીવુડ, પ્રવાસ-પર્યટન, પર્યાવરણ તથા આરોગ્ય વિષયક માહિતીના રોમાંચક ખજાનાનો આવિષ્કાર !!

www.swadesh.news

સ્વદેશમાં વિજ્ઞાપનો માટે ઈમેલ એડ્રેસ પર માહિતી મોકલો

info@swadesh.news

હવે પછી નીચે મુજબના સરનામે તમામ પોસ્ટલ વ્યવહાર કરવા વિનંતી.

23 Lyric Road, Brampton ON L6S 0B4.



ઠંડા પ્રદેશ કેનેડાના લિટનમાં ગરમીનો પારો એકાએક 49 ડીગ્રીને કેમ આંબી ગયો?

હિટડોમ : પ્રદૂષણ બદલ કુદરતનું રિએક્શન

બેકરતા પણ વધુ દાયકાથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે ઝઝૂમી રહેલી દુનિયા માટે આ વર્ષે સૌથી વધુ ગંભીર અને ચેતવણીરૂપ કિસ્સો કેનેડા અને અમેરિકાથી મળ્યો છે. સામાન્ય સંજોગોમાં ઠંડા રહેતા આ પ્રદેશમાં આ વખતે ગરમીનો પારો 48 ડીગ્રીથી પણ ઉંચે જઈ ચઢ્યો હતો. કેનેડાના લિટન સહિતના વિસ્તારમાં 49.5 ડીગ્રી તાપમાન સાથે લાખો લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. માનવ શરીર ઋતુ પ્રમાણે અનુકૂળ થવા ટેવાયેલું છે. ધીમે-ધીમે તાપમાનમાં થતી ૩૫ ડિગ્રીની વધઘટ માણસનું શરીર સહન કરી લે છે. પરંતુ હવે ૬૦ ડિગ્રીની વધઘટ સહન કરવું પડે તો શું થાય તેની તો કલ્પના જ કરવી પડે તેમ છે.

કેનેડામાં માર્ચન ૧૦ ડિગ્રી સુધી પહોંચતો પારો આ વર્ષે ૪૯.૫ ડિગ્રીએ પહોંચી ગયો હતો. આ વાતને હજી માંડ ૨૫-૩૦ દિવસ જ વીત્યા છે. આ સમયે કેનેડામાં ૮૦૦ કરતા વધુ લોકોના ગરમીને કારણે મોત થયા હતા. હિટડોમને કારણે અનુભવાયેલી ગરમીએ કેનેડિયનોની હાલત ખરાબ કરી નાંખી હતી. કેનેડાના લિટન નામના ગામમાં સામાન્ય રીતે વધુમાં વધુ ૨૮થી ૩૦ ડિગ્રી સેલ્સિયસ ગરમી પડતી હોય છે, પણ તાજેતરમાં તાપમાનનો પારો ૪૯.૫ ડિગ્રી સેલ્સિયસને આંબી ગયો. એ જ રીતે બ્રિટિશ કોલમ્બિયા અને અલબર્ટામાં ગરમીના રેકોર્ડ તૂટી ગયા છે. સામાન્ય રીતે કેનેડા તેની ઠંડીને કારણે પ્રસિદ્ધ છે. પહેલી વખત તે તેની આકરી ગરમીને લીધે દુનિયાભરમાં ચર્ચામાં આવ્યું છે. અંદાજે ૮૦૦ લોકો ગરમીને કારણે મોતને ભેટવા એ કેનેડા જેવા દેશ માટે મોટી બાબત છે.

કેનેડામાં અગાઉનો રેકોર્ડ ૪૫ ડિગ્રી ગરમીનો નોંધાયો હતો. આ પહેલા ૧૯૩૭માં આટલી વધી ગરમી પડી હતી. કેનેડામાં બહુ ઓછા લોકો એ.સી.નો ઉપયોગ કરે છે. કારણ કે, ત્યાં સામાન્ય રીતે ગરમીનો પ્રશ્ન હોતો નથી. અનેક ઘરોમાં તો આજે પણ એસી લગાડાયા નથી. કારણ કે ત્યાંનું તાપમાન નીચું રહેતું હોય છે. લિટન નામના જે ગામમાં સર્વાધિક તાપમાન નોંધાયું ત્યાં તો બિલકુલ કોઈને ત્યાં એસી નથી. આથી આ વખતે લોકો એ.સી.ની સુવિધા ધરાવતા જાહેર સ્થળો પર ધસી ગયા હતા. આ ઉપરાંત કેટલાક દરિયા કિનારે જતા રહ્યા હતા. જોકે દરિયા કિનારે ગરમી ન લાગે એ એક ભ્રમ છે. જ્યાં ૧૦૦ ટકા ભેજ હોય ત્યાં ૩૫ ડિગ્રી તાપમાન પણ અસહ્ય બની જાય છે. કારણ કે, ૧૦૦ ટકા ભેજ હોય ત્યારે શરીરમાંથી પરસેવો નીકળવો બંધ થઈ જાય છે. પરિણામે શરીરને ઠંડું કરવાની નેચરલ કલિંગ સિસ્ટમ ખોરવાઈ જાય છે. સૂકા પ્રદેશની ૫૦



ટકા ડીગ્રી અને ભેજવાળા પ્રદેશની ૩૫ ડીગ્રી ગરમી એકસરખી હોય છે. કદાચ ભેજવાળા પ્રદેશની ૩૫ ડીગ્રીની ગરમી વધારે અસહ્ય બની જાય છે. હવે ગરમીની સમસ્યાના ઉકેલ માટે વાનકુવરમાં અસ્થાયી મિસ્ટિંગ સ્ટેશન ઊભા કરવામાં આવ્યા છે. કેનેડાના વિજ્ઞાનીઓએ તો નાગરિકોને ચેતવણી આપી છે કે, હવે આપણે સખત ગરમી માટે તૈયાર રહેવાનું છે. ઘણા લોકો કહેશે કે ક્લોઈમેટ ચેન્જ કુદરતી પરિબળ છે.

પરંતુ હકીકતમાં ક્લોઈમેટ ચેન્જ કુદરતી પરિબળ સાથે હવે માનવસર્જિત પણ છે. માનવ દ્વારા જે પ્રદૂષણ ફેલાવાય રહ્યું છે તેને કારણે નેચર રીએક્શનરી બની ગઈ છે. દુષ્કાળ, અતિવૃષ્ટિ, પૂર, વાવાઝોડા આ બધું પહેલા પણ હતું. કિન્તુ માનવજન્ય પ્રદૂષણને કારણે તેની ફીકવન્સી વધી ગઈ છે. લિટનમાં ૩૦ ડિગ્રીથી પારો એકાએક

પ્રાસંગિક
ધવલ શુક્લ

દુષ્કાળ, અતિવૃષ્ટિ, પૂર, વાવાઝોડા જેવી આફતો વર્ષોથી માનવીને માથા ખડકાતી રહી છે પરંતુ માનવ સર્જિત બેફામ પ્રદૂષણને કારણે હવે તેની તીવ્રતા વધી ગઈ છે

૪૯ ડિગ્રીએ કેવી રીતે પહોંચી ગયો ? તે સવાલ મહત્વનો બન્યો છે. અત્યારે તે પાછળ હિટડોમનું કારણ આપવામાં આવી રહ્યું છે.

હિટડોમને સામાન્ય રીતે સમજીએ તો હવા ગરમ થાય એટલે હલકી થાય છે. જે બાદ હલકી થયેલી હવા ઉપર જાય છે. હવે ઉપરથી ઢાંકણું બંધ હોય તો હવા ત્યાંને ત્યાં ધૂમ્મા કરે છે. હિટડોમના

કિસ્સામાં ગરમ હવા વધુ ઉંચે જઈ શકતી નથી. બીજી તરફ નીચેથી બીજી ગરમ હવા ઉપર તરફ ગતિ કરતી રહે છે. એટલે પહેલેથી જ ઉપર જે ગરમ હવા હોય તેની સાથે તે ટકરાય છે. આવા સંજોગોમાં ગરમ હવાનું પ્રેશર વધી જાય છે. જેની સીધી અસર વાતાવરણમાં વર્તાય છે. આ પ્રક્રિયાને હિટડોમ કહેવાય છે. આ વર્ષે કેનેડા આ જ સિસ્ટમનો ભોગ બન્યું છે. બીજી તરફ અમેરિકામાં પણ અગાઉની તુલનાએ રેકોર્ડબ્રેક ગરમી પડી છે. સાઈબિરિયાનું રેકોર્ડરેટર સમુદાય હવે ગરમ થવા લાગ્યું છે. યમનમાં વધતી

ગરમીને કારણે મધમાખી ઉછરે કેન્દ્રો ખતમ થવા માંડ્યા છે. અમેરિકાના ઓરેગોન સ્ટેટમાં ગરમીને કારણે ૬૦ લોકોનાં મોત થયાં છે. તેમાંથી ૪૫ મોત તો એકલા માલ્ટનોમામાં નોંધાયા છે. માલ્ટનોમ ઓરેગોનની સૌથી મોટી કાઉન્ટી છે. ગરમીથી

ક્ષેત્રોની તુલનાએ બમણી ઝડપથી વધી રહ્યું છે. ક્લોઈમેટ એનાલિટિક્સના મત પ્રમાણે છેલ્લા ૧૧,૦૦૦ વર્ષમાં પૃથ્વી અત્યારે સર્વાધિક ગરમીનો સામનો કરી રહી છે. પૂર્વ ઔદ્યોગિક કાળની તુલનાએ વિશ્વનું સરેરાશ તાપમાન એક ડીગ્રી વધી ગયું છે. સરેરાશ તાપમાન એક ડીગ્રી વધવું એ બહુ મોટી વાત છે. ક્લોઈમેટ ચેન્જ નિયંત્રિત કરવાનો બે રસ્તા દુનિયા પાસે છે. એક માણસે પોતે અપનાવવો પડે. બીજો, સરકારે. સૌથી પહેલા તો કોલસાથી વીજળી બનાવવાનું બંધ કરવું આવશ્યક છે. કોલસાનું બનન સંપૂર્ણપણે બંધ કરી દેવું જોઈએ. બિનપ્રણાલિગત ઊર્જા સ્રોતના ઉત્પાદન અને વપરાશ પર ટેક્સ ઝીરો કરી નાખવો જોઈએ. ઈલેક્ટ્રિક વાહનોનું ચલણ વધારવું જોઈએ. ખાલી ઈલેક્ટ્રિક સ્ક્રૂટર્સ વધે એ પૂરતું નથી. બસો અને ખટારા પણ ઈલેક્ટ્રિકિટીથી ચાલે તે દીશામાં આયોજન થવું જોઈએ. વળી, એ ઈલેક્ટ્રિકિટી કોલસા કે ડિઝલની મદદથી પેદા કરવામાં આવે તો પાછું એનું એ જ થાય. એટલે એ ખાસ કન્કર્મ કરવું પડે કે વીજળી પણ પવન, સૌર જેવા બિન પ્રણાલિગત સ્રોત થકી જ પ્રાપ્ત થાય.

લોકોએ વાહનોનો બિનજરૂરી વપરાશ ઘટાડવો જોઈએ. બને ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ. નજીકના અંતરે જવાનું હોય તો સ્ક્રૂટરને બદલે સાઈકલનો ઉપયોગ કરવાથી પણ દેશ અને દુનિયાની મોટી સેવા કરી શકાશે. બીજી તફ દરેક દેશની સરકારે કાર્બન ટેક્સ નાખવો જોઈએ. કેનેડા અને ચીનની સરકાર અત્યારે આવા પગલાં લઈ રહ્યા છે. પ્રણાલિગત સ્રોત થકી ઊર્જા ઉત્પન્ન કરનારી કે તેનો વપરાશ કરનારી કંપનીઓને કાર્બન ટેક્સ ભરવો પડે અને બિનપ્રણાલિગત સ્રોતોમાંથી ઊર્જા ઉત્પન્ન કરનારી કંપનીઓને ટેક્સમાંથી મુક્તિ મળે તો પ્રદૂષણ ઘટાડવામાં મોટા ફાળો મળશે. કોઈ એક દેશની સરકાર આ પોલીસી અપનાવે તો પણ ઝાઝો ફેર નહીં પડે. કારણ કે, આકાશને સરહદ નથી. એક દેશનું પ્રદૂષણ બીજા દેશ તરફ પગ કરતું જ હોય છે. આવા સંજોગોમાં પ્રદૂષણ ઘટાડવાની વાતો માત્ર જ સમીટ પુરતી સીમીત ન રહે અને દરેક દેશ ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઈમાં સહભાગી બને તો પ્રદૂષણની માત્રા ઘટાડી શકાશે તે નિશ્ચિત છે. અત્યાર સુધી ગ્લોબલ વોર્મિંગનો મુદ્દો જ સમીટમાં ચર્ચાતો રહ્યો છે. વિકસીત દેશ હવે પર્યાવરણની દુહાઈ આપીને વિકાસશીલ દેશોને શીખ આપે છે. પરંતુ સમીટ પછી ખુદ વિકસીત દેશ પણ પ્રદૂષણ ઘટાડવાની દીશામાં નક્કર પગલા લેતાં નથી. તેને કારણે સમસ્યા ઠેરની ઠેર રહી ગઈ છે.



SHARP
INTERNATIONAL
IMMIGRATION SERVICES



CANADA IMMIGRATION

Specialized in :

Entrepreneur/Investor Business/
Self Employed/Farm Owner

- LMIA/WORK PERMIT
- EXPRESS ENTRY
- CANADIAN EXPERIENCE CLASS
- FEDERAL SKILLED WORKER/SKILLED TRADE
- SUPER VISA & VISITOR VISA
- STUDY & WORK PERMIT
- Work / Study /Visitor Permit Extension
- PARENTS/CHILD/SPOUSAL SPONSORSHIP
- REFUGEES/APPEALS
- DETENTION REVIEWS
- CRIMINAL PARDONS
- POST GRADUATION WORK PERMIT
- CITIZENSHIP & PR CARD RENEWAL APPLICATIONS



AMI MEHTA

IMMIGRATION PRACTITIONER

**BUSINESS IMMIGRATION
TO CANADA REQUIRES
3 CR NET WORTH/
1.5 CR INVESTMENT/
BUSINESS OWNERSHIP/
MANAGEMENT EXP**

**REJECTED
CASES WELCOME**

**ONLINE IELTS
SPOKEN ENGLISH
CLASSES ON ZOOM**

**SUPER VISA INSURANCE / TRAVEL INSURANCE
/ PR 90 DAYS INSURANCE**

94- 499 MAIN STREET SOUTH, SHOPPERS
WORLD MALL, BRAMPTON, ONT

**416-745-2466
905-230-7855**

101-102 SIDDHARTH COMPLEX, BESIDES
EXPRESS HOTEL, ALKAPURI, VADODRA-390007

**91-9428973911
91-9512157817**

Email.: info@siis.ca

Website.: www.siis.ca



રોજ કરો પુશઅપ-એક્સરસાઈઝ, તમારા સ્તનમાં આવી જશે ઉભાર

કસરત વખતે સ્પોર્ટ્સ બ્રા પહેરવાની વાત કરી લીધા પછી આપણે એ પણ જાણી લઈએ કે સ્પોર્ટ્સ બ્રા પહેરતીને કઈ કઈ કસરતો કરવી જોઈએ. દા.ત. પુશઅપ્સને પુરુષોની કસરત ગણાવવામાં આવે છે, પરંતુ ત્રીસ સેકન્ડ સુધી પુશ કર્યા પછી એક મિનિટનો આરામ લઈ ફી ત્રીસ સેકન્ડ પુશ કરવાની ક્રિયા ત્રણ વખત રોજેરોજ કરતા રહો તો મહિલાઓની ચેસ્ટ વળાંકદાર અને મજબૂત બનશે.

પુશઅપ્સ ત્રણ રીતે કરી શકાય. જો ઉમર ત્રીસની નીચે હોય અને ગોઠણની કોઈ સમસ્યા ન હોય તો ફર્ષ ઉપર બે પગના પંજા અને બંને હાથના પંજા મૂકીને શરીર ફર્ષને સમાંતર રાખો. આ વખતે તમારા હાથના પંજા તમારા ખભાની નીચે આવશે. હવે શરીરને કોઈ વળાંક આપ્યા વગર બંને હાથ સીધા કરી ખભાથી શરીર ઉપર લઈ જાવ અને એક-બે સેકન્ડ પછી ફી હાથ કોણીથી વાળીને શરૂઆતની સ્થિતિમાં આવી જાવ.

બીજી પદ્ધતિ ગોઠણમાં થોડીક સમસ્યા હોય તેમના માટે છે. ખુરશી, સોફા, ઓટલો વગેરે જેવી કોઈ ઊંચી જગ્યા પર બંને હાથના પંજા

અને ફર્ષ ઉપર પગના પંજા ગોઠવી શરીરને સીધું રાખી ઊભા રહો. આ વખતે પણ તમારા હાથના પંજા તમારા ખભાની નીચે આવશે. હવે શરીરને જરાય વળાંક આપ્યા વગર બંને હાથ સીધા કરો. એથી ખભાથી શરીર ખુરશી, સોફા કે ઓટલા જેવી જગ્યાથી દૂર જશે. એક-બે સેકન્ડ પછી ફી પહેલાંની સ્થિતિમાં આવી જાઓ.

જો ગોઠણની સમસ્યા વધી ગઈ હોય તો દીવાલ સામે ઊભા રહો. દીવાલથી અંતર એટલું હોવું જોઈએ કે બંને હાથના પંજા દીવાલ ઉપર મૂકી ત્યારે હાથ સીધા રહે. આટલે દૂર તમારા પગ પણ હોવા જોઈએ જેથી શરીર સીધું ટકારી રહે. હવે બંને હાથ કોણીથી વાળીને તમારો ખભો દીવાલ નજીક લઈ જાવ. પછી દીવાલને ધક્કો મારવાનો પ્રયાસ કરો. તેથી બંને હાથ સીધા થઈ જશે અને તમે પહેલાં જેવી સ્થિતિમાં આવી જશો.

જ્યારે તમારા હાથ કોણીથી વળે ત્યારે તમારા પંજા તમારા ખભાની નીચે જ આવવા જોઈએ. રોજેરોજ આ કસરત કરવાથી તમારી ચેસ્ટના સ્નાયુઓ કસાશે અને બ્રેસ્ટ ઉત્તર બનશે.

યોમાસામાં આ વસ્તુઓનું કરો ભરપુર સેવન, નહીં રહે શરદી-ખાંસીની બિમારી

આદુ : આદુ એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટી-ઈન્ફ્લેમેટરી, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાઈરલ, વગેરે ગુણથી ભરપુર છે. તેનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. શરદી, ખાંસી, તાવ વગેરે મોસમી રોગોનો શિકાર થવાનું જોખમ ઘટી જાય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમે તેની ચા દરરોજ પી શકો છો. આ માટે, 1 કપ પાણીમાં 1 ચમચી આદુ ઉકાળો. ત્યારબાદ તેને ગાળી લો અને સ્વાદ પ્રમાણે મધ અને લીંબુનો રસ મિશ્ર કર્યા પછી પીવો. આ સિવાય તમે આદુ સાથે મિલક ટી ચા પી શકો છો.

લસણ : રોગપ્રતિકારક શક્તિ વધારવામાં લસણ ખૂબ અસરકારક માનવામાં આવે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લસણ

એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટી-ઈન્ફ્લેમેટરી, એન્ટી બેક્ટેરિયલ વગેરે ગુણધર્મોથી ભરપુર છે. વાયરસ સામે લડવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી પાચનતંત્ર મજબૂત થાય છે. યોમાસા દરમિયાન સ્વસ્થ રહેવા માટે ચોક્કસ તેનું સેવન કરો. તમે દરરોજ લસણનું સેવન કરી શકો છો.

હળદર : હળદરમાં પોષક તત્વો, એન્ટી ઓક્સિડેન્ટ્સ, એન્ટિ-એજિંગ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરલ અને ઔષધીય ગુણ હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ ઝડપથી વધારવામાં મદદ કરે છે. યોમાસા દરમિયાન તંદુરસ્ત રહેવા માટે, તેને તમારા દૈનિક આહારમાં ચોક્કસપણે શામેલ કરો. તમે શાકભાજીમાં હળદર ઉમેરીને ખાઈ શકો છો. તમે હળદર વાળુ દૂધ પી શકો છો.

SMS Hijack Fraud



મોબાઈલની ખામી શોધીને તેમાંથી બેન્કીંગ સંબંધિત SMS માહિતી હેકર સુધી પહોંચાડવામાં આવે છે. આ માહિતી કોઈ એપ્લિકેશન અથવા તો મોબાઈલ માં છુપું રહેલું સ્પાયવેર દ્વારા હેકર સુધી પહોંચે છે. ગૂગલ પ્લે સ્ટોરમાં છેતરપિંડીવાળી એપ્લિકેશન મળી આવી છે જે આ રીતે યુઝર્સની માહિતી લીક કરે છે. આ એપ્લિકેશન 7 લાખ થી વધુ લોકો ડાઉનલોડ કરી ચુક્યા છે.

હેકરએ મોટેભાગે દક્ષિણ-પશ્ચિમ એશિયા અને અરબી દ્વીપકલ્પના યુઝર્સને ટાર્ગેટ/શિકાર બનાવ્યા હતા. આ તારણો સાયબર સિક્યુરિટી કંપનીઓ Trend Micro અને McAfee દ્વારા સ્વતંત્ર રીતે નોંધાયા હતા. વધુમાં જાણવા મળ્યું હતું કે આ એપ્લિકેશન 7 લાખ થી વધુ વખત ડાઉનલોડ થઈ છે અને યુઝર્સની માહિતી હેકર સુધી પહોંચી ગઈ છે. ત્યારબાદ આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવવામાં આવી.

McAfee જણાવે છે કે ફોટો એડીટીંગ એપ, વોલપેપર સંબંધિત એપ, puzzles એપ, કીબોર્ડ સ્ક્રીન એપ, કેમેરા સંબંધિત એપ માં માલવેર હોય છે જે ડેટા ને લગતી

છેતરપિંડી કરવા માટે ઉપયોગી છે. એજ રીતે આ એપ્લિકેશનમાં સ્પાયવેર પણ હોય છે. જે SMS હાઈજેક કરી અનધિકૃત ટ્રાન્ઝેક્શન કરી શકે છે. માલવેરમાં સામાન્ય રીતે વર્ઝનિંગ નામના કોડિંગ તકનીકનો ઉપયોગ થાય છે. યુઝર્સનો વિશ્વાસ બનાવી રાખવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર એપ્લિકેશનને કલીન એપ્લિકેશન તરીકે ડેવલોપર્સ દ્વારા અપલોડ કરવામાં આવે છે. પછી અપડેટ દ્વારા માલવેર ઉમેરવામાં આવે છે. આ કોડ પેલોડ(payload) તરીકે ઓળખવામાં આવે છે જે કોઈ પણ ફોરમેટમાં હોય છે.

SMS હાઈજેકથી બચવા માટે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ જે-તે એપ્લિકેશન કઈ-કઈ પરમિશન માંગે છે તે કાળજી પૂર્વક વાંચ્યા બાદ જ એક્સેપ્ટ કરવી. આ એપ્લિકેશનનું લીસ્ટ મારા ટ્વીટર એકાઉન્ટ પર મુકવામાં આવ્યું છે. જો તમારા મોબાઈલમાં આ એપ્લિકેશન ઈન્સ્ટોલ હોય તો તરત જ કાઢી નાખવી. એપ્લિકેશનમાં માલવેરની માહિતી મળતા ગૂગલએ પણ 2020માં 1700થી વધુ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી હટાવવામાં આવી છે.

@beinghumanmj

DIVINE YOGA

By Geeta

Children Yoga Class

Every Tuesday 5-6 PM

Adult Yoga Class

Every Saturday 9-10 AM

Gratitude Program

Every Thursday 9 PM

Join-today-on-ZOOM!

: Classes Available :

One to One Individual and Therapeutic

Geeta Tailor

416-456-2261

Contact Geeta at
 divineyogabygeeta@gmail.com
 IG & FB: @divineyogabygeeta

SHIV FINANCIAL SERVICES

VISITOR TO CANADA AND NEW IMMIGRANTS INSURANCE

Personal Tax - File is Free For New Immigrants.

Full Time Service Provider

Serving Community Since 2009

- Life Insurance, Critical Illness Insurance & Mortgage Insurance with Money Back Option
- Health & Dental Plan
- Segregated Fund • Personal Tax-file

* અમે બધી ટોપની ઈન્સ્યુરન્સ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરીએ છીએ.

* New Life Insurance Advisors are recruited.

::: For Free Quotation & Consultation :::

જગદીશ સેવક

(Financial Advisor)

Cell: 647-236-7620

SHIV FINANCIAL SERVICES

"Proper insurance coverage is Peace of Mind"

Email: sevak_2007@hotmail.com

www.shivfinancialservices.ca

GUARANTEED LOWEST PREMIUM



ક. મા. મુનશી નવલકથા લખે અને ઇંદુલાલ યાજ્ઞિકને વંચાવે

ઇંદુલાલ યાજ્ઞિક એ ઇંદુલાલને વંચાવે. ઇંદુલાલ દિવસોમાં તેઓ ઇંદુલાલને વંચાવે. ઇંદુલાલ મહાગુજરાતના પ્રણેતા અને ઇંદુલાલ તરીકે ઓળખાયા. એક પત્રકાર, એક પોલિટિશિયન, સ્વાતંત્ર્યસેનાની, નાટ્યકાર, લેખક, ફિલ્મ મેકરથી માંડીને સંસદસભ્ય સુધીની લાંબી કારકિર્દી દ્વારા તેઓ બહુમુખી પ્રતિભા રહ્યા. લોકોએ તેમને અમદાવાદ જેવા શ્રીમંત નગરના ઓલિયા-ફકીર પણ કહ્યા.

યંગ ઇન્ડિયા

તા. ૨૨ ફેબ્રુઆરી, ૧૯૨૨માં જન્મેલા ઇંદુલાલ યાજ્ઞિક મૂળ નડિયાદના. તેઓ નાના હતા ત્યારે જ પિતાનું અવસાન થયું. નડિયાદમાં જ ભણી ૧૯૦૬માં મૅટ્રિક પાસ કરી તે પછી અમદાવાદની ગુજરાત કોલેજમાં દાખલ થયા. ઇન્ટરમિડિએટ પરીક્ષા પાસ કર્યા બાદ મુંબઈની સેટ ઝેવિયર્સ કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને બી.એ. થયા.

૧૯૧૨માં એલ.એલ.બી. કર્યું. કોલેજ કાળ દરમિયાન તેઓ એનિ બેસન્ટથી પ્રભાવિત હતા. ૧૯૧૫માં જમનાદાસ દ્વારકાદાસ અને શંકરલાલ બેંકરની સાથે રહી અંગ્રેજી વિષયમાં 'યંગ ઇન્ડિયા' નામનું સામાયિક શરૂ કર્યું. તા. ૧૫મી જુલાઈ, ૧૯૧૫માં તેમણે તેમના તંત્રીપદેથી 'નવજીવન અને સત્ય' નામનું માસિક શરૂ કર્યું. શરૂઆતમાં વકીલાત પણ કરી. 'હિંદુસ્તાન' નામના દૈનિકમાં અગ્ર લેખો પણ લખ્યા. ૧૯૨૨માં 'યુગધર્મ' શરૂ કર્યું. ૧૯૧૫માં વકીલાત છોડી સમાજ-દેશસેવામાં જોડાયા. વચ્ચેના ગાળા દરમિયાન તેમણે 'પાવાગઢનું પતન' નામની ફિલ્મ પણ બનાવી. ફરી પાછા દેશસેવામાં લાગી ગયા.

મુનશીના પડોશી

ગાંધીજીના આગમન પહેલાં તેઓ જાહેર જીવન વિશે વિચારતા થયા હતા. ગાંધીજીના આગમન પહેલાં ઇંદુલાલ યાજ્ઞિક ગુજરાતમાં નવજીવન પ્રગટાવવાના મનોરથ સેવતા હતા. કનૈયાલાલ મુનશી તેમના પડોશી હતા. આ બેઉ વચ્ચે વિચારવિમર્શ થતો. એ વખતે કનૈયાલાલ મુનશી 'વેરની વસૂલાત' નવલકથા લખતા હતા. સાંજે મુનશી તેનાં પ્રકરણ લખે અને રાત્રે

માવળંકર અને ઇંદુલાલ મંત્રીઓ બન્યા.

સરદાર સાથે મતભેદો એ પછીના સમયમાં ઇંદુલાલ યાજ્ઞિક અને વલ્લભભાઈ પટેલ વચ્ચે મતભેદો ઊભા થયા. ઇંદુલાલ યાજ્ઞિકે પ્રદેશ કોંગ્રેસનું મંત્રીપદ છોડી દીધું, પરંતુ ગાંધીજી આવવાના હોઈ થોડા દિવસ એ રાજીનામું રોકી રખાયું. એ પછી મળેલી સભામાં ગાંધીજીએ કહ્યું : 'ભાઈ ઇંદુલાલ જેવો ઉદ્યમી માણસ ગુજરાતમાં બીજો એક પણ નથી. તેમના

બાદ પાંચસો ગુજરાતીઓની સભા વિચારમાં પડી ગઈ. કેટલાંકની આંખો ભીની થઈ. વલ્લભભાઈ પટેલ ઊઠ્યા. તેઓ પણ વ્યથિત હતા. ભારે દર્દભર્યા સ્વરે તેઓ બોલ્યા : 'રાજીનામું આપવું, આપીને છૂટી જવું, તેના કરતાં રાજીનામું આપ્યા સિવાય અંદર રહેવું વધારે દુઃખદ છે. ઇંદુલાલ મારા નાના ભાઈ છે. અમે આજ સુધી એ રીતે જ રહ્યા છીએ. આજે આવો પ્રસંગ આવે છે ત્યારે હું શું કરું ? મારાથી વધુ બોલી શકાતું નથી. હું વધારે

સમિતિમાં ખાલી જ રખાઈ. સભાએ તે પૂરી ના કરી. તેમના જેવું બીજું કોઈ નામ ના જડયું. ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિમાંથી રાજીનામું આપ્યા બાદ ઇંદુલાલ યાજ્ઞિકે સાહિત્ય ક્ષેત્રમાં ઝંપલાવ્યું. ૧૯૨૨માં તેમણે 'યુગધર્મ' શરૂ કર્યું.

દેશભરમાં ધૂમ્મા

એ પછીના સમયમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું. ઇંદુલાલ યાજ્ઞિકે પક્ષનું મંત્રીપદ છોડ્યું હતું. કોંગ્રેસ પક્ષ નહીં. એ અધિવેશનમાં સવિનય કાનૂન ભંગનો ઠરાવ થયો. એ આંદોલનની મુખ્ય જવાબદારી નિભાવવા વલ્લભભાઈ પટેલે જ ઇંદુલાલ યાજ્ઞિકને આગ્રહ કર્યો. ઇંદુલાલ યાજ્ઞિકે એ જવાબદારી સ્વીકારી અને જોશભેર દેશમાં ધૂમ્મા લાગ્યા. એ આંદોલનના કારણે અંગ્રેજોની પોલીસે તેમની ધરપકડ કરી. તે પછી યરવડા જેલમાં તેઓ ૧૦ માસ સુધી ગાંધીજીની સાથે રહ્યા. અહીં છૂટ્યા બાદ રચનાત્મક પ્રવૃત્તિ યરવડા જેલમાં પણ કેટલાક પ્રશ્નોની ચર્ચા કરતાં ગાંધીજી સાથે તેમને મતભેદો થયા. કારાવાસમાંથી છૂટ્યા બાદ 'યુગધર્મ'માં તેમણે ગાંધીજીને બે જાહેર પત્રો લખ્યા અને તેઓ ગાંધીજીથી દૂર થઈ ગયા.

જીવન સંભારણા

તેઓ ગુજરાત છોડીને મુંબઈ ચાલ્યા ગયા. એ સમયના ચિત્રનું આલેખન કરતાં શારદાબહેન મહેતા 'જીવન સંભારણા'માં લખે છે કે 'નવજીવન યંગ ઇન્ડિયામાં કામ કરીને રાત્રે ભાર એક વાગે તેઓ ઘેર આવે ત્યારે મને તો તેમની દયા આવતી. સેવાની કોઈ કદર માટે કરતું નથી, પરંતુ સામાન્ય કદરના બદલે અપમાન અને ગાળો જ સહન કરવાનાં હોય ત્યારે તે અસહ્ય થાય. ઇંદુલાલના નસીબમાં એ જ હતું. સમાજમાં તેમણે જે કાંઈ સેવા કરી તેની કદર ના થઈ. મારા કુટુંબમાં તેમના સંપર્કથી બહુ લાભ થયો. મારાં બાળકોને કેળવવામાં તેમનો મોટો ફાળો હતો.' કહેવાય છે કે તેઓ 'નવજીવન' ચલાવવામાં ગાંધીજીના જમણો હાથ હોવા છતાં તેમણે પોતાનું વ્યક્તિત્વ દબાવી ન રાખ્યું. તેઓ સ્વતંત્ર વિચારોના માનવી હતા. મોટી વ્યક્તિઓની હામાં હા કદી ના પુરાવતા. અલભત આ વસવસો શારદાબહેન મહેતાને કાયમ રહ્યો નહીં હોય. વર્ષો પછી ઇંદુલાલ ફરી પાછા ગુજરાતમાં આવ્યા

અને ગુજરાતે તેમને અનહદ પ્રેમ આપ્યો.

યુરોપમાં ચા વેચી

બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે ૧૯૨૮માં તેમણે ફિલ્મ બનાવી. સફળતા ના મળતી. તેઓ હતાશ થઈ ગયા. મિત્રની મદદથી વિદેશ ગયા. ૧૯૩૨માં યુરોપમાં ફર્યા, આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા તેમણે યુરોપમાં ચા વેચી, સિગારેટો વેચી, ભારતીય ખાણું શરૂ કરી કમાવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. પાંચ વર્ષ વિદેશોમાં રહ્યા. માતૃભૂમિના ખંચાણથી તેઓ ૧૯૩૫માં ફરી ભારત પાછા આવ્યા. ફરી દાદાસાહેબ માવળંકર અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે જોડાયા અને ફરી એ સંબંધ તૂટ્યો. ૧૯૩૭માં ઇંદુલાલ યાજ્ઞિકે કિસાન પ્રવૃત્તિમાં રસ લેવા માંડ્યો. બીજા વિશ્વયુદ્ધ બાદ ફરી તેમને જેલ થઈ. જેલમાંથી છૂટ્યા બાદ રચનાત્મક પ્રવૃત્તિ શરૂ કરી. છેલ્લે નેનપુરમાં આશ્રમ સ્થાપ્યો. વાત્રકના રમણીય કિનારાના આ આશ્રમમાં રહેતાં ઇંદુલાલ યાજ્ઞિકે લખ્યું : 'મેં હવે આપણા દેશની પ્રજાલિકાને અનુસરીને વાત્રકના રમણીય કિનારે ગ્રામ પ્રવેશમાં મારો વાસો કર્યો છે. કુટુંબ વિહોણો બનીને આશ્રમના જ કુમારોના કુટુંબમાં મહાલું છું ! ૧૯૪૫-૪૬માં તેઓ કોંગ્રેસમાં ફરી સક્રિય થયા હતા. ગાંધીજી અને સરદાર તો હવે રાષ્ટ્રીય કક્ષાએ વ્યસ્ત થઈ ગયા હતા, પરંતુ એ વખતે કોંગ્રેસના પ્રાદેશિક કક્ષાના જે નેતાઓ હતા તે ઇંદુલાલને સ્વીકારી શક્યા નહીં, તેથી ઇંદુલાલ એ વખતે કોંગ્રેસમાં રહી શક્યા નહીં.


આઝાદી મળી

૧૯૫૦માં ગુજરાતમાં શાંતિ આંદોલન શરૂ થયું. શાંતિ સમિતિના ઉપક્રમે તેઓ સોવિયેત સંઘ અને ચીન ગયા. પરંતુ આવનારાં વર્ષોમાં 'મહાગુજરાત'નું જબરદસ્ત આંદોલન તેમના આગમનની રાહ જોઈ રહ્યું હતું, કારણ કે હવે આવનારો 'મહાગુજરાત' માટેનો જંગ ગુજરાતી અસ્મિતાનો હતો.

દેવેન્દ્ર પટેલ

સંપર્ક

+91 98792 07102



૧૯૩૫માં ફરી ભારત પાછા આવ્યા. ફરી દાદાસાહેબ માવળંકર અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે જોડાયા અને ફરી એ સંબંધ તૂટ્યો. ૧૯૩૭માં ઇંદુલાલ યાજ્ઞિકે કિસાન પ્રવૃત્તિમાં રસ લેવા માંડ્યો. બીજા વિશ્વયુદ્ધ બાદ ફરી તેમને જેલ થઈ. જેલમાંથી છૂટ્યા બાદ રચનાત્મક પ્રવૃત્તિ શરૂ કરી. છેલ્લે નેનપુરમાં આશ્રમ સ્થાપ્યો.

જેવો પ્રામાણિક માણસ મળે પછી નહીં. તેમને ગુમાવવા ગુજરાતને પાલવે તેમ નથી, પરંતુ તેમના અને વલ્લભભાઈ પટેલના સ્વભાવમાં ફરક છે તેથી બંને સાથે કામ કરી શકે તેમ નથી. પણ દુઃખની સાથે ભાઈ ઇંદુલાલનું રાજીનામું સ્વીકારવું એવી મારી સલાહ છે.' ગાંધીજીના આ ઉદ્બોધન

બોલી નહીં શકું.' આટલું બોલ્યા પછી સરદાર સાહેબ આંખમાંથી ઉભરાતા આંસુ રોકવા બેસી ગયા. બીજા બાજુ ઇંદુલાલ યાજ્ઞિકની આંખમાંથી આંસુ છલકાવા લાગ્યા. આખી સભા જાણે કે રડવા લાગી. સભામાં સ્મશાન જેવી શાંતિ પથરાઈ. તે પછીના સમયમાં ઇંદુલાલ યાજ્ઞિકની જગા પ્રાંતિક

જાણવા જેવું

ત્રણ-ત્રણ આંખવાળું ન્યુઝીલેન્ડનું ટુઆટારા

દેવેક પ્રાણીને બે જ આંખ હોય છે. પરંતુ એક ત્રણ આંખવાળું પ્રાણી પણ છે. ન્યુઝીલેન્ડમાં જોવા મળતું ટુઆટારા ત્રણ આંખ ધરાવે છે. મગર જેવા દેખાવનું પણ મગર કરતા નાનું આ પ્રાણી લીલા રંગનું હોય છે. બેથી અઠી ફૂટ લંબાઈના કાર્ચિડા જેવા ટુઆટારાના માથા પર ત્રીજી આંખ હોય છે. જો કે મોટી ઉંમરના ટુઆટારાની આ ત્રીજી આંખ ચામડી નીચે ઢંકાય જાય છે. આ ત્રીજી આંખ તેને સૂર્યના અલ્ટ્રા વાયોલેટ કિરણોથી બચાવવા માટે હોય છે. તેમ વિજ્ઞાનીઓ માને છે. ટુઆટારાનું માથુ કાર્ચિડા જેવું હોય છે. પરંતુ તેનું ઉપલું જડબું ચાંચની જેમ આગળ લંબાયેલું હોય છે, જે તેના નીચલા જડબામાં દાંતની બે હાર હોય છે. તેની બંને આંખો જુદી જુદી દિશામાં ખેંચી શકે છે. તેની આંખમાં અજવાળા અને અંધારામાં જોવા માટે જુદા જુદા પ્રકારના કોષો હોય છે.

સમુદ્રની અલૌકિક સૌંદર્યસૃષ્ટિ : પરવાળાના ટાપુઓ

પૃથ્વી પર પર્વતો, નદીઓ, જંગલો અને દરિયાકિનારા એક અલગ સૌંદર્ય સૃષ્ટિ છે. સમુદ્રમાં પણ ઘણી ભૌગોલિક રચનાઓ અદ્ભુત હોય છે તેમાં પરવાળાના ટાપુ કે કોરલ રિફ્ સૌથી વધુ સૌંદર્યસ્થાન છે. દરિયામાં રહેતા નાના કોમળ જીવો પોતાના રક્ષણ માટે શરીર ફરતે સખત શંખ અને છીપલાનું આવરણ બનાવતા હોય છે. આ જીવડાના શરીરમાં ખતખતના રસાયણો હોય છે. આ જીવો નાશ પામે ત્યારે દરિયાકાંઠે તેના અવશેષો જમા થાય છે. દરિયાના પાણીના મોજા આ અવશેષો કાંઠે ઘેરવી એક વિશિષ્ટ રચના ઊભી કરે છે. વર્ષોની આ પ્રક્રિયાથી સમુદ્રમાં કેટલાક સ્થળે આવા અવશેષો જમા થઈને વિશાળ ટાપુઓ બનેલા છે તેને પરવાળાના ટાપુ કે કોરલ રિફ્ કહે છે. પરવાળાના ટાપુ મોટે ભાગે કેલ્શિયમ કાર્બોનેટના થરના બનેલા ખડકો હોય છે.



વેક્સીન લીધી છતાં બ્રિટનમાં 50% કોરોના સંક્રમિત

બ્રિટનમાં વકરી રહેલો કોરોના, બ્રિટન માટે આગામી સાત દિવસ અત્યંત મહત્વના: આરોગ્ય નિષ્ણાત

લંડન : બ્રિટનમાં કોરોનાનો ચેપ ફરીથી ઝડપથી ફેલાઈ રહ્યો છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે અહીં રસી લેનારા પુખ્ત લોકોમાં પણ કોરોનાનો ચેપ ઝડપથી વધી રહ્યો છે. બ્રિટનની કિંગ્સ કોલેજ લંડનના વરિષ્ઠ વાઈરસ ટ્રેકિંગ સ્પેશ્યાલિસ્ટ પ્રો. ટીમ સ્પેક્ટરનું કહેવું છે કે બ્રિટનમાં કોરોનાના રોગચાળાની ત્રીજી લહેર ટોચ પર છે. અહીં કોરોનાગ્રસ્ત લોકોમાં ૮૭.૨ ટકા લોકો એવા છે જેમને રસી લગાવાઈ ચૂકી છે. છ જુલાઈના રોજ ૧૨૮૦૫ એવા લોકોમાં વાઈરસને સમર્થન મળ્યું જેને રસી લાગી ચૂકી હતી. આનાથી તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે

કે છ જુલાઈએ કોરોના પોઝિટિવના મળેલા કેસોમાં ૫૦ ટકા કેસ રસી લઈ ચૂકનારા લોકોમાં મળ્યા હતા. પ્રોફેસર સ્પેક્ટરના અનુમાન મુજબ આગામી સમયમાં આ ગ્રાફ હજી પણ ઉચકાઈ શકે છે. તેમણે ચેતવણી આપી હતી કે હજી પણ રોગચાળાને વધારે ભયાનક થતી રોકવા માટેની તક છે, જો તેનો ઉપયોગ કરવામાં ન આવ્યો તો પછી સ્થિતિ વણસતા વાર નહીં લાગે. સાઉથ ટાઈનેસાઈડ કાઉન્સિલના પબ્લિક હેલ્થ ડિરેક્ટર પ્રોફેસર ટોમ હોલ મુજબ બ્રિટનમાં ત્રીજી લહેરમાં કોરોનાની રસી લીધી હોય તેવા લોકોને પણ તેનો ચેપ લાગ્યો હોવાનું માલૂમ પડ્યું છે.

ઈન્ડોનેશિયામાં 24 કલાકમાં કોરોનાના 47899 કેસ નોંધાયા

વિશ્વમાં કોરોના વાઈરસનો નવો ડેલ્ટા વેરિઅન્ટ સતત પ્રસરી રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠને તેને લઈને નવી ચેતવણી ઉચ્ચારી છે કે ૧૧૧ દેશોમાં પ્રસરી ચૂકેલો ડેલ્ટા વેરિઅન્ટ ઝડપથી વિશ્વને ભરડામાં લઈ લેશે અને તેને પરિણામે વિશ્વના હેલ્થ સેક્ટર પર ફરીથી દબાણ ઊભું થઈ શકે છે. દરમિયાન કોરોના સંક્રમણના મોરચે તમામને પાછળ રાખીને ઈન્ડોનેશિયાએ આગેવાની લીધી છે. પાછલા ૨૪ કલાક દરમિયાન વિશ્વના સૌથી વધુ નવા કેસ ઈન્ડોનેશિયામાં ૪૭,૮૯૯ નોંધાયા હતા. એક મહિના અગાઉ ઈન્ડોનેશિયામાં રોજના ૧૦,૦૦૦ કેસ નોંધાતા હતા. સત્તાવાળાને ભય છે કે નવો વેરિઅન્ટ હવે દેશના મુખ્ય ટાપુ જાવાની બહાર પ્રસરી રહ્યો છે.

અમેરિકામાં એક જ દિવસમાં 27557 નવા કેસ આવ્યા

અમેરિકામાં ૩૨ જૂને ૧૧,૩૦૦ કેસ નોંધાયા હતા તે પાછલા ૨૪ કલાક દરમિયાન ૨૭,૫૫૭ નવા કેસ ઉપર પહોંચી ગયા હતા. પાછલા ૨૪ કલાક દરમિયાન અમેરિકામાં કોરોનાના કારણે ૪૩૭ દર્દીના મોત થયા હતાં. દરમિયાન છેલ્લા એક દિવસ દરમિયાન બ્રાઝિલમાં ૪૫,૦૯૪ નવા કેસ નોંધાયા હતાં જ્યારે સ્પેનમાં ૪૩,૯૬૦માં નવા કેસ આવતાં દેશમાં ભયનો માહોલ ફેલાયો હતો. લોકોને ત્રીજી વેવની ચિંતા સત્તાવાળા લાગી છે.

યુરોપમાં પૂરપ્રકોપ : ૩૩નાં મોત, ૭૦ લોકો લાપતા



બર્લિન : પશ્ચિમ યુરોપમાં ભયાનક પૂર આવ્યું હતું. આ પૂરપ્રકોપના કારણે જર્મની અને બેલ્જિયમમાં હાહાકાર મચી ગયો હતો. જર્મનીમાં ૨૦ સહિત કુલ ૩૩ લોકોનાં મોત થયા હતા અને હજુ ૭૦ જેટલાં લોકો લાપતા હોવાથી મૃત્યુ આંક વધે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી હતી. જીવ બચાવવા છાપરા ઉપર ચડી ગયેલા સેંકડો લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બે બચાવ કર્મચારીનું પૂરમાં ડૂબી જવાથી મોત થયું હતું.

ફાન્સની વોચડોગે ગૂગલને રૂ. ૪,૪૦૦ કરોડનો દંડ ફટકાર્યો

પેરિસ : ટેકનોલોજી કંપની ગૂગલ પર ફાન્સે ૫૦૦ મિલિયન યૂરો (અંદાજે રૂ. ૪,૪૦૦ કરોડ અથવા ૫૮૩ ડોલર)નો દંડ ફટકાર્યો છે. ગૂગલને તેના પ્લેટફોર્મ પર સ્થાનિક ન્યૂઝ એજન્સીઓના આર્ટિકલ દર્શાવવા માટે વળતર ચૂકવવા વાટાઘાટો કરવામાં નિષ્ફળ ગયા પછી આ દંડ કરાયો છે. કંપનીને કોપીરાઈટ કાયદાના ભંગ બદલ દોષિત ઠેરવવામાં આવી છે, જેના પગલે કંપની પર ૫૦૦ મિલિયન યૂરો કરાયો છે, જે ગૂગલને અત્યાર સુધીમાં

થયેલો સૌથી મોટો દંડ છે. ફાન્સની એન્ટીટ્રસ્ટ વોચડોગે આલ્ફાબેટ એન્ડ કંપની પર ગૂગલને અસ્થાયી રીતે આદેશો ના માનવા માટે દોષિત ઠેરવી છે. ફાન્સની ઓથોરિટીએ મંગળવારે જણાવ્યું હતું કે, આલ્ફાબેટ ઈન્કે. તેની ગૂગલ ન્યૂઝ સર્વિસ પર સ્થાનિક ન્યૂઝ એજન્સીઓના આર્ટિકલ દર્શાવવા માટે વળતર ચૂકવવાના વર્ષ ૨૦૨૦ના આદેશોની અવગણના કરી હતી. એક જ કંપનીને ફાન્સમાં એન્ટીટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલો આ બીજો સૌથી મોટો દંડ છે.

ઘરાકમાં કોરોના હોસ્પિટલમાં આગ 64નાં મોત થયા, 100થી વધુ ઘાયલ

બગદાદ

દક્ષિણ ઈરાકની કોરોના વાઈરસ હોસ્પિટલમાં આગ લાગતા 54 લોકોનાં મોત થયા છે તેમ ઈરાકના મીડિયા અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આગની આ ઘટનામાં અન્ય 100થી વધુ લોકોનાં મોત થયા છે. નસિરિયાહ શહેરની અલ હુસેન ટીચિંગ હોસ્પિટલમાં આ આગ લાગી હતી. ગઈકાલે મોડી રાતે આગ લાગ્યા પછી આજે સવાર પીડિતાના સગાઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતાં.



હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાઓએ પોતાના સંબંધીઓને શોધવા દોડાદોડ કરી મૂકી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે ઓક્સિજન સિલિન્ડરમાં વિસ્ફોટ થવાને કારણે આગ ફાટી નીકળી હતી. ત્રણ મહિના પહેલા જ આ નવા વોર્ડની રચના કરાઈ હતી. જેમાં 70 બેડ હતાં.

ભારત બાદ હવે યુરોપમાં પણ વોટ્સ-એપની ડેટા પ્રાઈવસી નીતિનો વિરોધ

જાન્યુઆરીમાં પ્રાઈવસી પોલિસી લાગુ થઈ, એ પ્રમાણે ડેટા ફેસબુકને શેર કરી શકાતો હતો

બ્રસેલ્સ : ભારતમાં વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી ચર્ચાનું કેન્દ્ર બની છે અને તે મુદ્દો કોર્ટમાં પહોંચી ચૂક્યો છે. યુરોપમાં પણ એવું જ થયું હતું. યુરોપીયન કન્ઝ્યુમર ઓર્ગનાઈઝેશન અને તે સિવાયના આઠ સભ્યોએ વોટ્સએપની આ નીતિનો વિરોધ કર્યો હતો અને તેની સામે યુરોપીયન સંઘ સમક્ષ ફરિયાદ કરી છે.



લાગુ કરી હતી. એ નવી પોલિસી પ્રમાણે વોટ્સએપના ડેટા ફેસબુકને શેર કરવાની છૂટ મળતી હતી. તેનો છૂટોછવાયો વિરોધ થયો હતો, પરંતુ હવે મામલો યુરોપીયન સંઘ સુધી

પહોંચ્યો છે. યુરોપીયન કન્ઝ્યુમર ઓર્ગનાઈઝેશન અને તે સિવાયના આઠ સભ્યોએ નવી પ્રાઈવસી પોલિસી મુદ્દે વોટ્સએપની ઝાટકણી કાઢી હતી અને તે ગેરવાજબી ગણાવી હતી. યુરોપીયન કન્ઝ્યુમર ઓર્ગનાઈઝેશન અને આઠ સભ્યોએ યુરોપીયન કમિશન તેમ જ યુરોપીયન કન્ઝ્યુમર ઓથોરિટીને ફરિયાદ કરી છે. તેમાં વોટ્સએપની નવી નીતિને ગેરબંધારણીય ગણીને પગલાં ભરવાની ભલામણ કરવામાં આવી છે.

ભારતની વીજળી કંપની, સરકારી સિસ્ટમને નિશાન બનાવતા પાકિસ્તાની હેકર

ઈસ્લામાબાદ

નવી દિલ્હી: પાકિસ્તાની હેકરો ભારતની વીજળી કંપનીઓ અને સરકારી સિસ્ટમને નિશાન બનાવી રહ્યા છે. હમણા સુધી એમ માનવામાં આવતું હતું કે ભારત પર થતા સાઈબર હુમલામાં કેટલાય હુમલા પાછળ ચીનનો હાથ હોય છે, પરંતુ હવે પાકિસ્તાન પણ તેમા સામેલ હોવાના અહેવાલ આવ્યા છે. આ વર્ષના પ્રારંભમાં જ એક નવા મેલવેરની મદદથી પાકિસ્તાન સ્થિત સાઈબર એટેકર્સ ભારતની વીજ કંપનીઓ અને એક સરકારી સંગઠનને લક્ષ્યાંક બનાવ્યું હતું. સાઈબર એટેકર્સે નવા પ્રકારના રિમોટ એક્સેસ ટ્રોજન (રેટ)ને ઈન્સ્ટોલ કર્યો હતો. તેનાથી સામેવાળી વ્યક્તિના કમ્પ્યુટર પર નજર રાખી શકાય છે.

અબજોપતિ રિચર્ડ બ્રેનસનનું નવું સપનું, હવે ચંદ્ર પર હોટલ ખોલશે

લંડન

અંતરિક્ષની યાત્રા કરીને ઈતિહાસ સર્જનારા અબજોપતિ ઉદ્યોગપતિ રિચર્ડ બ્રેનસને હવે નવું સપનું જોયું છે. જે પ્રમાણે રિચર્ડ બ્રેનસન ચંદ્ર પર હોટલ બનાવવા માંગે છે. અંતરિક્ષમાં ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે બ્રેનસન પ્રયત્નશીલ છે. તેમણે વાયદો કર્યો છે કે, આગામી સમયમાં સ્પેસમાં જવા માટે તેમની કંપની વર્જિન ગેલેક્ટિક તરફથી જે ટિકિટની કિંમત છે તે પણ ઓછી થઈ જશે. હાલમાં રિચર્ડ બ્રેનસન પોતે જ યાત્રા પર ગયા હતા તેવી અવકાશી સફરની એક ટિકિટની કિંમત 2.50 લાખ

ડોલર છે. જોકે બ્રેનસન હવે એવું અવકાશી યાન બનાવવા માંગે છે જે અવકાશમાં વધારે ઉચાઈ સુધી જઈ શકે અને વધારે લાંબા સમય સુધી ઉડાન ભરી શકે. બ્રેનસને કહ્યું હતું કે, મેં ચંદ્ર પર એક હોટલ બનાવવાનું સપનું હંમેશા જોયું છે. આ કામ આપણે કરી શકીશું કે આપણી ભાવી પેઢી કરશે તે જોવાનું રહે છે. મને જો સમયમળ્યો તો હું પોતે આ હોટલ બનાવવાનું સપનું પૂરું કરીશ. તેમણે કહ્યું હતું કે, અંતરિક્ષમાં જવા માટે વધારે સ્પેસ પ્લેન અને રોકેટ ઉપલબ્ધ થશે તો અંતરિક્ષ યાત્રા માટેની ટિકિટનો અર્થ પણ ઓછો થઈ જશે.

પાકિસ્તાનના પેશાવરમાં બસ બ્લાસ્ટ: નવ ચીની કામદારોના કડૂણ મોત

પેશાવર

પેશાવર: ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનમાં એક બસમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં કુલ 13 લોકોના મોત થયા હતા. તેમા ચીનના નવ કામદારોનો પણ સમાવેશ થાય છે. આ બસ ચીની એન્જિનિયરો, સર્વેયરો અને કર્મચારીઓને ખૈબરપખ્તુનવામાં બની રહેલા બંધ પર લઈ જઈ રહી હતી. હજી સુધી તે સ્પષ્ટ થયું નથી કે આ વિસ્ફોટ રસ્તા પર લાગેલા કોઈ સાધનની મદદથી થયો છે કે બસની અંદર કોઈ વિસ્ફોટક પદાર્થ મૂકવામાં આવ્યો હતો. ખૈબરપખ્તુનવાના ટોચના પોલીસ અધિકારી મોઅજ્જમ જાહ અંસારીએ ચીની નાગરિકો, બે સૈનિકો અને બે સ્થાનિક લોકોના મોતને સમર્થન આપ્યું છે.

**Dr. Salim Kapadia** DDS

Dental Centre

SK

Your Perfect
Smile...Is Our Greatest
Satisfaction!**SERVICES**

- Smile Makeover
- Laser Teeth Whitening
- Dental Implants - Start to Finish
- Single Visit Root Canal
- Re-treatment of Failing Root Canal
- Surgical Wisdom Teeth Extraction
- Scaling & Root Planing
- White Tooth Colored Filling
- Implant Retained Dentures
- Complete & Partial Dentures
- Lumineers & Veneers
- Crown & Bridges (Zirconia & E.max)



1825 Markham Rd, Suite 102
Scarborough, ON M1B 4Z9
drsalimkapadiadental.com

416-321-3268**વાસ્તુશાંતી પૂજા-યજ્ઞ****વેદોક્ત પદ્ધતિથી સંપૂર્ણ વાસ્તુ શાસ્ત્રથી વાસ્તુ શાંતિ પૂજા યજ્ઞ**

ઘર પૂજા સ્થાન છે. ઘરમાં જ સ્વર્ગ છે. ઘરમાં જ શાંતિનો આધાર છે. અને ઘરમાં જ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને લક્ષ્મીનો વાસ છે. પરંતુ જો આ બધી શ્રેષ્ઠતા આપનાં ઘરમાં ના હોય તો ઘરનાં કહેવાય તેને નર્ગ કહેવાય તો આપના નવા ઘરને સ્વર્ગ બનાવવા માટે સચોટ અને શાસ્ત્રોક્ત પદ્ધતિથી વાસ્તુશાંતિ યજ્ઞ થવો જરૂરી છે. કારણ કે જ્યારે નવા ભવનનું નિર્માણ કરવામાં આવે છે ત્યારે તેના ભૂગર્ભમાંથી ખોદકામથી આઠ વસ્તુઓ દોષ યુક્ત નિકળે છે તદઉપરાંત નર-અને પશુના અસ્થિ નિકળવાથી ભૂમિદોષ લાગે છે જેનાથી ઘર સ્વર્ગ નહિ પરંતુ નર્ગ બની સ્મશાન જેવું થઈ જાય છે. આવા અશુભ દોષનાં નિવારણ માટે વાસ્તુ શાંતિ યજ્ઞ કરાવવો.

કથા, વાસ્તુ, બેભીશાવર, ગૃહપ્રવેશ, નવચંડી, લઘુરુદ્ર, રુદ્રી પાઠ, ચંડીપાઠ દરેક પ્રકારના હવન અને પૂજા વિધિ કરાવનાર, જન્માક્ષર બનાવવા તથા જોવડાવવા માટે મળો

શાસ્ત્રી મિલનભાઈ ત્રિવેદી આણંદ (બોરસદ) ગુજરાત વાળા
Mobile : 647 770 5984

॥ શ્રી ગણેશાય નમઃ ॥

આપની દરેક સમસ્યાનું સમાધાન સાધના અનુષ્ઠાનથી કરાવવામાં આવશે**સચોટ અને શાસ્ત્રોક્ત જ્યોતિષ સલાહ અને નિદાન-વિધાન**

નવા, જનમાક્ષર બનાવવા અને જોવડાવવા, કુંડળીમેળાપ, કાલસર્પદોષ, ગ્રહણદોષ પિતૃદોષ, શનીપનોતી, લગ્નયોગ, મકાન-યોગ, ગુપ્તરોગ, દેવુમુક્તિ, શિગ્રવિવાહ, શિગ્રનોકરી પ્રાપ્તિ, બાળકોના ભણવા માટે વિદ્યા યોગ, વિદેશગમન યોગ તથા આપની કોઈપણ ગુપ્ત સમસ્યા, ગુપ્ત રોગ, ગુપ્ત શત્રુનિવારણ માટે મળો. શું આપના બાળકો પુત્ર-પુત્રી ગલત માર્ગથી પાછા વાળવા માંગો છો, શું આપના ઘર પરિવાર ઉપર કોઈએ મેલી વિદ્યા કરેલ છે, શું આપના ઘરમાં હંમેશા લડાઈ-ઝઘડા થાય છે, શું આપનો ભાગ્યોદય થવામાં વિલંબ થાય છે. શું આપના ઘર પરિવાર ઉપર કોઈક સંમોહન વશીકરણ કરેલ છે. શું આપ હંમેશા કોઈ મોટી બિમારીના શિકાર છો તેનો ઈલાજ કર્યા છતાં પણ તેનું નિવારણ નહિ થતું, શું આપનાં વ્યાપાર ધંધાને લગતી કોઈ સમસ્યા છે તો આવી જીવનની દરેક સમસ્યાનાં નિવારણ માટે આજેજ અમારી મૂલાકાત લો અને સચોટ શાસ્ત્રોક્ત વિધાનથી સમસ્યાનું નિવારણ કરાવો.

દરેક પ્રકારના ગ્રહોના નંગ, ચંત્રોગ, સ્ફટિકની માળા, શિવલિંગ, ઘોડાની નાળ, શિયાળાસિંગિ, હથ્થા જોડી, વૈજંતીબિજની માળા, મુંગાની માળા, રુદ્રાક્ષ માળા, મેરુપૃષ્ઠ શ્રી યંત્ર, ગોમતીચક્ર દરેક વસ્તુવિધી કરેલ પ્રાણપ્રતિષ્ઠત વાળી મળશે.

